

Since 1925...

જ્ઞાતિ પ્રવાહનું સાપ્તાહિક માધ્યમ

ક.દ.ઓ. પ્રકાશ સમીક્ષા



C.D.O. PRAKASH SAMIKSHA

Visit us at www.prakashsamiksha.com
E-mail : kdoprakash@gmail.com

RNI રજુ. બાદ વર્ષ : ૧૬ . અંક : ૪૪ . તા.૨૬ ઓક્ટો. થી ૦૧ નવેમ્બર ૧૩ . વાર્ષિક લવાજમ ૫૦ . Regn.No. MH/MR/East/53/2012-14

દક્ષિણ ભારત કચ્છી દશા ઓસવાલ જૈન એકમની ૨૯ મી વાર્ષિક સભા હૈદરાબાદ મહાજનને આંગણે



દિપ પ્રાગટ્ય - નરસીનાથાની છબીને હાર



હૈદરાબાદની બહેનો દ્વારા નવકાર મંત્રનું પઠન



સંબોધન કરી રહેલા પ્રમુખ મણીકાંતભાઈ



મંચસ્થ દક્ષિણ ભારત એકમના પદાધિકારીઓ



વાર્ષિક સભામાં ઉપસ્થિત બહેનો અને ભાઈઓ



દક્ષિણ ભારત એકમના બોર્ડની મીટીંગ



મહિલા મિલન



૩મ ઢાતા
માતુશ્રી સોનબાઈ
મુલજી પટેલ
પરિવારનું સન્માન



૩મ ઢાતા
શ્રી જયચંદ હેમરાજ
મૈશેરીનું સન્માન



૩મ ઢાતા શ્રી દિનેશ મુલજી પીરનું સન્માન



૩મ ઢાતા માતુશ્રી રાજબાઈ પદમશી મોતાનું સન્માન



ઑફીસ ઢાતા મીનાબેન સતીશભાઈ, મોતીચંદભાઈ
તેમજ લતાબેન મણિકાંત મોમાયાનું સન્માન

દક્ષિણ ભારત કચ્છી દશા ઓસવાલ જૈન એકમની ૨૯ મી વાર્ષિક સભા હૈદરાબાદ મહાજનને આંગણે



ક્ષેત્રમાં પ્રથમ આવેલ વિદ્યાર્થીનીનું સન્માન



સાંસ્કૃતિક કાર્યક્રમ



કુલપાકજી તિથે ભાવના



કુલપાકજી તિથે આરતી



કુલપાકજી તિથે રાસગરબા



આભારવિધી કરતા સતીશભાઈ



હૈદરાબાદી મેહમાનગતિ



હૈદરાબાદી મહાજનની યુવાશક્તિ



હૈદરાબાદી મહાજનની નારીશક્તિ



હૈદરાબાદી મહાજનના કારોબારી સભ્યો



રજીસ્ટ્રેશનની જવાબદારી સંભાળનારા સભ્યો

આધતંત્રીઓ**“પ્રકાશ”**

ડૉ. વેલજી પાશ્ચીર ગોસર

“સમીક્ષા”સનત્ શાહ અને
ગોવિંદજી જીવરાજ લોડાયા**“પ્રકાશ સમીક્ષા”**

સનત્ શાહ

: તંત્રી :

રાયચંદ આર. નાગડા

વ્યવસ્થાપક :

ચંદ્રસેન મોમાયા

મો. 9324618606

સમિતિ સભ્યો

કિરીટ લક્ષ્મીચંદ લાપસીયા

રાયચંદ રતનશી નાગડા

શરદ કાંતિલાલ શાહ (નાગડા)

કેશરસિંહ આણંદજી ખોના

તિલકચંદ કુંવરજી લોડાયા

કિરીટ ખેતશી મુનવર

કાશ્મીરા વિરેન્દ્ર લુઠીયા

હિરાચંદ દામજી દંડ

પંકજ પ્રતાપ શાહ

ચંદ્રસેન હીરાચંદ મોમાયા

શૈલેશ સનત્ શાહ

જ્યંત વિશનજી છેડા

અંક નં. 44/2013**: કાર્યાલય :**

પોસ્ટ/કુરીઅર પત્રવ્યવહાર માટે સરનામું

C/o. Shri. R. R. Nagda,

29/41, Tamarind Lane,

Behind Poomima Restaurant,

Rajabahadur Comp,

Nr. Stock Exchange Bldg,

Fort, Mumbai - 400 001.

સમય : બપોરે ૧ થી ૪ ફૂકન
શનિ./રવિ. અને જાહેર રજાના બંધચાલુ અંક માટે મેટર
સ્વીકાર માત્ર મંગળવાર સુધી

પ્રકાશ-સમીક્ષા હવે નેટ પર....

www.prakashsamiksha.com

E-mail : kdoprakash@gmail.com

નોંધ : આ પત્રમાં પ્રકાશિત થતા લેખકોનો સ્વતંત્ર અભિપ્રાય/મંતવ્યો સાથે તંત્રીમંડળ સહમત જ છે એમ માનવું નહીં. તેમજ આરોગ્યને લગતા લેખો કે કોઈ જાહેરાતોમાં કરવામાં આવતા દાવાઓ/વિધાનો અંગે પ્રકાશ-સમીક્ષા સમિતિની કોઈ જવાબદારી નથી.

જ્ઞાતિની રહેઠાણ સમસ્યાનું સમગ્ર અવલોકન અને તાજેતરના પ્રયાસો નું તટસ્થ મૂલ્યાંકન

જ્ઞાતિની રહેઠાણ સમસ્યા ખરા અર્થમાં અનેક પાસાંવાળી ઘટના છે. તેના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છે.

૧. આવનારા સમયમાં મોટા શહેરોમાં નહીં નાના શહેરોમાં પણ નગર સતત ફેલાતું રહેતું હોવાથી નજીકમાં રહેનારાઓ વચ્ચેજ સંબંધો રહી શકશે.

૨. મુંબઈ જેવા મહાનગરોમાં તો ફ્લેટની કીમંત એટલી વધી ગઈ છે કે મહિને દહાડે લાખ રૂપીયા કમાનાર પણ ૪૫ વર્ષના ન થાય ત્યાં સુધી પોતાના ઘરનું સપનું પુરું કરી શકે તેમ નથી. નજીકના ભવિષ્યમાં આવી હાલત બેંગલોર, હૈદરાબાદ, અમદાવાદ, પુના, જેવા નગરોની થાય તો નવાઈ નહીં.

૩. રૂના વ્યવસાય તથા કોપરા / તેજાનાના વ્યવસાયને કારણે જ્ઞાતિના ૨૫% લોકો જ્યાં વસતા હતા ત્યાં રહેવાનું તેમને માટે બિનઆવશ્યક જ નહીં, પ્રગતિ રૂંધનારું બની ગયું છે.

૪. એક જ જગ્યાએ વ્યાજબી નફા સાથે સાધન સંપન્નના ફ્લેટ કે બંગલા, ન નફા ન નુકસાનના ધોરણે ઉચ્ચ મધ્યમ વર્ગ માટેના ફ્લેટો તથા જરૂરતમંદો માટે ૧૦% કે ૧૫% આવક જેટલા ભાડે જરૂરતમંદોના ઘર એક સાથે બાંધવાની યોજના થઈ શકે તો સારા વિસ્તારમાં જ્ઞાતિની કોલોની કરી શકાય.

જ્ઞાતિની રહેઠાણ સમસ્યા સંબંધી સમગ્ર ચિત્ર આવું છે ત્યારે જ્ઞાતિપાસે એકતરફ નાના શહેરોમાં સફળ રહેલ ઘણી રહેઠાણ યોજનાઓ છે. જ્યારે બીજી તરફ જ્ઞાતિની ૬૫-૭૦% જેટલી વસતિ જ્યાં રહે છે એવા મુંબઈમાં અનંતનાથજી ટ્રસ્ટના જૂના ભાડૂતોના પુનર્વસન તથા ડોંબિવલીથી સાવ છેવાડાના વિસ્તારમાં જરૂરતમંદોને વસાવવાની યોજનાઓ આકાર લઈ રહી છે.

ક.દ.ઓ.ની વસતીની ભાવી સંભાવનાઓની છણાવટ કરીએ તો તરજ નજર સામે આવે છે કે આવનારા વર્ષોમાં તે વધુને વધુ પ્રમાણમાં ભણેલા ઉચ્ચ મધ્યમ વર્ગની જ્ઞાતિમાં રૂપાંતરિત થતી જશે. એ દ્રષ્ટિએ બેંગલોર-હૈદરાબાદ-પુના-દિલ્લી-કચ્છમાં મુંદ્રામાં સત્વરે એકીસ્થળે સાધન સંપન્નો માટે વ્યાજબી નફો લઈ, ઉચ્ચ મધ્યમ વર્ગોએ માટે નનફા નનુકસાનના ધોરણે તથા જરૂરતમંદો માટે આવકના ૧૦% કે ૧૫% ભાડે રહેઠાણ મળતા હોય તેવી કોલોનીઓ વિકસાવવા પર ધ્યાન આપવું જોઈએ.

ક.દ.ઓ. પ્રકાશ સમીક્ષાની ઈ-મેલ આય.ડી બદલાય છે હવેથી ઈ-મેલ kdoprakash@gmail.com પર મોકલાવા.

Please Note New Email ID of C.D.O. Prakash Samiksha :
Email : kdoprakash@gmail.com

આ સંદર્ભમાં માત્ર મુંબઈના અને તે પણ જરૂરતમંદ જ્ઞાતિજનોની રહેઠાણ સમસ્યા ઉકેલવા માટે બે જ્ઞાતિ સંસ્થાઓ - હોપ ૧૦૦૦ તથા શ્રી અનંતનાથજી ટ્રસ્ટે હાથ મિલાવ્યા તે બાબત કહેવું પડે કે એ સમગ્ર જ્ઞાતિની રહેઠાણ સમસ્યાની વાત કરીએ તો માત્ર પડકારના ૧૦% ને ઝીલવાની વાત છે.

હોપ રૂ. ૧૦૦૦ એક મહાન પ્રયોગ હતો કોરપોરેટ કલચરથી જોખમ ફેલાવવાની રણનીતી સાથે જરૂરતમંદોની રહેઠાણી સમસ્યા ઉકેલવાના સામાજિક કર્તવ્ય પાર પાડવાનો.

હવે જ્યારે તેને કોરપોરેટ કલચર છોડીને જ્ઞાતિની એક શામ-દામ-દંડ ભેદની નીતિથી મિલકત વેચી થોડા કરોડ રૂપિયા એકઠા કરનારી તથા રહેઠાણ સમસ્યાં ઉકેલવાની માથાકુટ કરવી કે નહીં તે અંગે દ્વિધાભર્યું વલન ધરાવતી ધાર્મિક-સામાજિક સંસ્થા સાથે હાથ મિલાવે ત્યારે કોઈ પણ સમજદાર જ્ઞાતિજનોને એક મોટી પીછેહટ થયાનો અહેસાસ થાય જ.

મજાની વાત એ છે કે કાયદાકીય રીતે જરૂરી ન હોવા છતાં પૈસા મંજૂર કરાવવા મુંબઈ મહાજનશ્રીને વચ્ચમાં લાવવામાં આવે પણ આ ટ્રસ્ટ કે મહાજનની વ્યવસ્થાપક સમિતિની મુદત પછીય સક્રિય રહે તેવી કાયમી સમીતી બનાવવાનું મહાજનશ્રીની વ્યવસ્થાપક સમિતીના પદાધિકારીએ પર છોડી દેવામાં આવે એ તો એક અર્થમાં ગઈ ચુંટણીમાં મુંબઈમાં વસતા જ્ઞાતિજનોએ કરેલ ગાડરીયા મતદાનનો ગેરલાભ લેવા જેવી બાબત ગણાય.

ઈચ્છનીય એ છે કે હોપ ૧૦૦૦ કાંતો પોતાના કોરપોરેટ કલચરના રહે સમાજિક હેતુ સિધ્ધ કરવાનો પડકાર રૂપ માર્ગ પર મક્કમ રહેવાનો સકંલ્પ કરે અથવા પોતાનું કોઈક રીતે વિસર્જન કરે. અલબત્ત, જ્યારે સોચીના નાકામાંથી આખો હાથી નીકળી ગયો છે અને માત્ર પુંછડું બાકી છે ત્યારે આવા વિસર્જનની કોઈ આવશ્યકતા નથી.

જરૂર છે કોરપોરેટ કલચરના આધારે જોખમ ફેલાવીને નવું રોકાણ મેળવવાની, જે બહુ મુશ્કેલ નથી. આ વાત ધ્યાનમાં રાખીને હોપ ૧૦૦૦ એ અનંતનાથજી ટ્રસ્ટ પાસેથી અનંત છાયાના વેચાણથી મળેલ રકમનું જે વ્યાજ જમા થયું છે તે લોનરૂપે માંગ્યું હોત તો પણ કામ થઈ જાત. હોપ ૧૦૦૦ના કોરપોરેટ કલચરના રહે રહેઠાણ સમસ્યા ઉકેલવાના ધ્યેય સાથે તે સુસંગત હોત.

અનંતનાથજી ટ્રસ્ટની વાત કરીએ તો અનંતછાયાના નિર્માણ વખતે જ્ઞાતિએ રહેઠાણ સમસ્યા માટે ફાળવેલા પૈસા બેકમાં અનામત મુકી તેના વ્યાજમાથી જ્ઞાતિજનોને ઉચ્ચ શિક્ષણ આપીતે રહે જ્ઞાતિજનોની રહેઠાણ સમસ્યા ઉકેલવા તેમને સક્કામ બનાવવાની વાત સાથે હમણાની હોપ ૧૦૦૦ સાથે સચુંકત પ્રોજેક્ટ લેવાની વાત સુસંગત નથી. વધુમા ચેરીટી કમીશનર અને હાયકોર્ટ સમક્ષ અનંતનાથ ટ્રસ્ટે જાહેર કરેલી નીતિ સાથે પણ આ વાત સુસંગત નથી. આ જોઈને થાય છે કે જો પાછલા બારણે કદાચ ચુંટણીમાં સફળ થવા રહેઠાણ યોજના લાવવી હોય તો રહેઠાણ યોજના માટે અતિ આગ્રહી વિરોધીઓ સાથે લાંબી કાયદાકીય લડત લડવાની શી જરૂર હતી?

અહીં એ વાતની યાદ આવે છે કે પાછલા બારણે રહેઠાણ યોજના સ્વિકારનાર અનંતનાથજી ટ્રસ્ટને અત્યારે જે વ્યક્તિ દોરવે છે તેને પોતે જરૂરતમંદ જ્ઞાતિજનો માટે ૫૦૦ ફ્લેટો આપવાનું વચન આપી તેનું પાલન ન કર્યું એટલે આ ટ્રસ્ટ બોર્ડ પાસે અને તેને આધારે આગળ વધવા ઈચ્છતા હોપ ૧૦૦૦ વાળાઓ પાસે સમજદાર જ્ઞાતિજનો શુ અપેક્ષા રાખી શકે?

રહેઠાણ સમસ્યા ઉકેલવાના જાહેર કરેલા ઉદ્દેશ્યથી નજીક આવેલી સંસ્થાઓ હકીકતમાં પોતાના લાંબા ગાળાના ધ્યેય છોડીને સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આ બધું કરી રહી છે. એવા સમજદારોના મત સાથે કોઈ પણ જ્ઞાતિજન સહમત થશે જ.

- ચંદ્રસેન મોમાયા

ઊંઘ એક કુદરતી પ્રવૃત્તિ છે. આખા દિવસની પ્રવૃત્તિ પછી આપણને ઊંઘ જોઈએ. સાધારણ રીતે ૬ની ૮ કલાકની શાંત ઊંઘ થવી જોઈએ. બાળકો વધુ સમય ઊંઘે છે. જેમ જેમ ઉંમર વધે તેમ ઊંઘ ઘટતી જાય છે. વૃધ્ધાવસ્થામાં ઊંઘ સાવ ઘટી જાય છે. એ ઉંમરે ૧ થી ૯ કલાકની ઊંઘ દુકડે દુકડે થાય તો ઉત્તમ. જેટલી ઊંઘ ઓછી એટલી માનસિક, શારીરિક તકલીફો વધુ. ૬ થી ૧૨ વર્ષના બાળકને ૯ કલાકની ઊંઘ જોઈએ. ૧૩ થી ૧૮ વર્ષનાને ૮ કલાકની ઊંઘ કરવી જોઈએ. બાળકો સમયસર, શાંત ઊંઘ લે અને પૌષ્ટિક ખોરાક ખાય તો અભ્યાસમાં આગળ હોય છે નહીં તો એકાગ્રતા અને યાદશક્તિ ઘટે. સ્કુલના દિવસે ઊંઘ ઓછી થાય અને પછી રજાના દિવસે વધુ ઊંઘ નુકશાન કરે એમ વૈજ્ઞાનિકો કહે છે. ૬ થી ૮ કલાકની શાંત ઊંઘ ન થાય તો ડૉક્ટરી ભાષામાં એને અનિદ્રા-ઈન્સોમ્નીઆ કહે છે. દરેક વ્યક્તિની ઊંઘની જરૂરિયાત અલગ અલગ હોય છે.

રાતના શરૂઆતના ભાગમાં ભોગી જાગે, એટલે કે જે ખાવાપીવામાં, ટેવોમાં, આચાર, વિચારમાં ભોગી

હોય તે રાતના શરૂમાં જાગે. બીજા ભાગમાં રોગી જાગે એટલે કે રોગ હોય તો દિવસનો થાકેલો રાતની શરૂમાં ઊંઘે પણ પછી જાગી જાય. જ્યારે યોગી ત્રીજા ભાગમાં જાગે એટલે કે યોગ કરનાર વ્યક્તિ વહેલી સવારે જાગે, યોગ કરે, બાગ-બગીચામાં, કુદરતી વાતાવરણમાં ફરવા જાય. કફ પ્રકૃતિવાળાની ઊંઘ ગાઢ હોય, દિવસભર સુસ્તી રહે જ્યારે વાત-પિત્ત પ્રકૃતિવાળાને ઊંઘ ઓછી. માટે વાત-પિત્ત વધે એવો આહાર-વિહાર ન કરવો, એવી ટેવો, ટેન્શન, ચિંતા, ગુસ્સાથી દુર રહેવું એટલે કે એવા આચાર, વિચાર ન કરવા જેનાથી વાત, પિત્ત વધે. હોર્મોન્સના ફેરફારને લીધે સ્ત્રીઓને પુરૂષો કરતાં ઊંઘ ઓછી હોય છે.

ઊંઘ એટલે થાકેલા શરીરનું ટોનિક. પુરતી ઊંઘ લેવાથી થાકેલા સ્નાયુ અને બીજા અવયવોને આરામ મળે. પૂરતી, શાંત ઊંઘ લેવાથી થાક ઉતરે છે, આપોઆપ નવી તાજગી પ્રાપ્ત થાય, મગ જને આરામ મળે, પાચન બરાબર થાય, ટ્રાયગ્લીસરાઈડમાં ઘટાડો થાય, બી.પી., બ્લડસુગર કંટ્રોલમાં રહે, ચામડીના કોષો રીપેર કરવાની



॥શ્રી ગોકિયાજી પાર્શ્વનાથાય નમઃ ॥

સસ્નેહ આમંત્રણ

શ્રી ક. ઇ. ઓ. જૈન જ્ઞાતિ રાપરગઢવારી - ગાની સિંઘોડી સંઘ

આયોજીત

પંચમ સ્નેહમિલન

ભારતભરમાં વસ્તા ગામવાસિયો તથા નિયાણી બહેનોને પાંચમાં સ્નેહમિલનમાં આમંત્રિત કરીએ છીએ.

સ્નેહમિલન રવિવાર તા. ૨૯-૧૨-૨૦૧૩ રોજ સવારના ૯.૩૦ થી રાતના ૮.૦૦ વાગ્યા સુધી શેઠ શ્રી નરશી નાથા સભાગૃહ, અનંત સિદ્ધી, એલ. બી. એસ. રોડ, ભાંડુપ (વેસ્ટ), મુંબઈ - ૭૮. ખાતે આયોજીત કરેલ છે. જેમાં ગામ વાસિયોના - સોલો ડાન્સ, ગ્રુપ ડાન્સ, મિમિકી, અભિનય, ગાયન, વાદન, નાટિકા આદિ સાંસ્કૃતિક કાર્યક્રમ સાદર કરવા માટે નું આવાહન કરવામાં આવેલ છે. નામ નોંધણી માટે નીચે મુજબ ના અધિકારીઓનો સંપર્ક તા. ૩૦-૧૧-૨૦૧૩ સુધીમાં કરવા વિનંતી છે.

સંપૂર્ણ કાર્યક્રમ નો સંચાલન - ચેતના હરિયા અને સાથી કલાકારો કરશે.

સંપૂર્ણ કાર્યક્રમના દાતાશ્રી

માતૃશ્રી ભય્યાબાઈ હરશી નાગશી લોડાયા પરિવાર હસ્તે અ. સૌ. વિજયાબેન ડુંવરજી લોડાયા

નિમંત્રક

શ્રી ક. ઇ. ઓ. રાપરગઢવારી - ગાની સિંઘોડી જૈન મિત્ર મંડળ



શ્રી વીરચંદ નરશી લોડાયા - ૯૫૯૪૬ ૦૦૯૦૦

શ્રી પ્રકુલ દેવજી નાગડા - ૯૩૨૨૨ ૨૦૨૦૪

કચ્છ કોઠારા સ્થાને ચામુંડામા ને નમતા મૈશેરી કુળના પરિવારજનો માટે**આશાપુરા મા અને સરચાઈમાના નામકરણ અને ભૂવાશ્રી કે ભોઈમાને જાગૃત કરવા**

કારતક સુદ ૧૨, બુધવાર, તા. ૧૩-૧૧-૨૦૧૩ થી કારતક સુદ પૂનમ, રવિવાર, તા. ૧૭-૧૧-૨૦૧૩ સુધીનો

જાહેર મહોત્સવ કાર્યક્રમ**કારતક સુદ ૧૧, બુધવાર, તા. ૧૩-૧૧-૨૦૧૩**

નવકારશી-બપોરની યા : શ્રી ડુંગરશી ટોકરશી મૈશેરી - કોઠારા - મુલુંડ
 બપોરનું જમણા : શ્રી માણેકજી પદમશી મૈશેરી પરિવાર - માંડવી
 સાંજનું જમણા : શ્રી ઊમરશી મેઘજી મૈશેરી - લાલા

કારતક સુદ ૧૨ ગુરૂવાર, તા. ૧૪-૧૧-૨૦૧૩

નવકારશી-બપોરની યા : શ્રી લાલજી દેવજી મૈશેરી - મોટી સિંઘોડી
 શ્રી રાઘવજી દેવજી મૈશેરી - મોટી સિંઘોડી
 શ્રી શા. ખીમજી રતનશી મૈશેરી-મોટી સિંઘોડી
 બપોરનું જમણા : શ્રી વિરચંદ લખમશી મૈશેરી લાલા-ભાંડુપ
 સાંજનું જમણા : મા. મંજુલાબેન ત્રીકમજી મૈશેરી-મોટી સિંઘોડી - થાણા

પાણીની પરબના દાતા પરિવાર

માતુશ્રી શાંતાબાઈ અમૃતલાલ નેણશી મૈશેરી લાલા - અમદાવાદ
 હસ્તે કમલેશ અમૃતલાલ મૈશેરી

મંડપના દાતા પરિવાર

શેઠશ્રી કલ્યાણજી માણેકજી મૈશેરી - માંડવી - મુલુંડ

ચંદીપાઠ અને શાસ્ત્રી પાઠના સજોડા

- ૧) મહેશ રાઘવજી મૈશેરી - લાલા-ભાંડુપ
- ૨) ગુલાબ ભવાનજી મૈશેરી - લાલા-અમદાવાદ
- ૩) ભરત નારાયણજી મૈશેરી - લાલા-ડોમ્બીવલી
- ૪) નામ આપકાર્ય
- ૫) નામ આપકાર્ય

કારતક સુદ ૧૩ શુક્રવાર, તા. ૧૫-૧૧-૨૦૧૩

નવકારશી-બપોરની યા : શ્રી શામજી મેઘજી મૈશેરી પરિવાર-લાલા-વિરમગામ
 બપોરનું જમણા : મા. માનબાઈ દામજી ખીચશી મૈશેરી લાલા-મુલુંડ
 સાંજનું જમણા : શ્રી ભરત નારાયણજી મૈશેરી-લાલા-ડોમ્બીવલી

કારતક સુદ ૧૪ શનિવાર, તા. ૧૬-૧૧-૨૦૧૩

નવકારશી-બપોરની યા : શ્રી ગોવિંદજી આંણદજી મૈશેરી- લાલા
 શ્રી લીલાધર આંણદજી મૈશેરી - લાલા-ઔરંગાબાદ
 બપોરનું જમણા : શ્રી જેઠાભાઈ રાજપાર મૈશેરી લાલા - મુલુંડ
 સાંજનું જમણા : નામ આપકાર્ય

કારતક સુદ પુનમ તા. ૧૭-૧૧-૨૦૧૩

નવકારશી-બપોરની યા : નામ આપકાર્ય
 બપોરનું જમણા : શેઠશ્રી જયંતિલાલ માણેકજી મૈશેરી-માંડવી - મુલુંડ
 હસ્તે જયાબેન રતિલાલ મૈશેરી તરફથી

સ્થાને દરરોજની સાંજની આરતીની ઉછામણીનો આદેશ દેવાશે નામકરણ અને ભૂવાશ્રીની નિમણુંક બાદ પ્રથમ માતાજીને નૈવેદ્ય ચડાવાનો આદેશ આપવામાં આવશે.

સૂચના :-

- ૧) મહોત્સવ દરમિયાન કોઈએ પણ કાળા કપડાં કે ઘૂઘરીવાળા ઝાંઝર પહેરવા નહીં.
- ૨) બહારગામથી કે ડાયરેક્ટ પધારતા ભાવીકોને અગાઉથી જાણ કરવા વિનંતી.
- ૩) વધુ વિગતની જાણકારી માટે કાર્યકરોનો સંપર્ક કરવો.
- ૪) અપીલ હર પરિવારોના ઘરમાંથી એક જણની પણ હાજરી હોવી જરૂરી છે.

અંદાજીત કાર્યક્રમ

તા. ૧૧-૧૧-૨૦૧૩....મુંબઈથી ભૂજ રવાના સયાજી એક્સપ્રેસ ટ્રેન દ્વારા બપોરની યા અને સાંજનું જમણા ટ્રેનમાં

તા. ૧૨-૧૧-૨૦૧૩...ગાંધીગ્રામ પહોચી બસમાં રવાના પંચતીર્થી માટે

૧) ભદ્રેશ્વર ૨) વાંકી ૩) ગુંદાલા (સચાઈમાતા અને રામદેવપીર મંદિર) ૪) બૌતેર જિનાલય (કોડાય) ૫) દેઢીયા

૧) સવારની નવકારશી - નામ આપકાર્ય ૨) બપોરની યા - નામ આપકાર્ય

૩) બપોરનું જમણા - માતુશ્રી લક્ષ્મીબાઈ જીવરાજ મૈશેરી - સાંઘાણ-ગોરેગામ હ. કિશોરભાઈ

૪) સાંજના ચોવિહાર - માતુશ્રી દમયંતીબેન ધનપતિ મૈશેરી - મોટી સિંઘોડી-ડોંબીવલી હ. નૂતન ભાવેશ મૈશેરી

તા. ૧૭-૧૧-૨૦૧૩, રવિવાર....કચ્છ કોઠારાથી બપોરના રવાના : ૧) માતાનો મઢ દર્શન ૨) જગવલ્લભ પાર્શ્વનાથ દર્શન ૩) જખ્ખ બૌતેરા ભૂજ રેલ્વે સ્ટેશન થી રાત્રે સયાજી એક્સપ્રેસ ટ્રેન દ્વારા રવાના, તા. ૧૮-૧૧-૨૦૧૩ બપોરનું જમણા (વલસાડ) ટ્રેનમાં આવવામાં આવશે. દરેક જણની આવવાની અને જવાની ટિકિટો આવી ગયેલ છે અને આપનો આચકેન્ટિટી કાર્ડ અથવા ફોટાવાળો પ્રુફ સાથે રાખવા વિનંતી.

લી. : ચામુંડામાતા પહેડી કમીટી કાર્યવાહક સંપર્ક ઓફિસ : મુકેશ દામજી મૈશેરી

C/o. સ્વસ્તીક ઓફટ્રોય સર્વિસ, ૧૦/એ, સી-વીંગ શ્રીરામ મંદિર સોસા., એલ.બી.એસ. માર્ગ, મુલુંડ ચેકનાકા, મુલુંડ (વે).

સંપર્ક : ૨૧૬૪ ૯૯૬૩, ૨૧૬૪ ૯૨૫૯, ૯૩૨૩૯ ૪૯૯૬૩, ૯૮૨૦૪ ૨૨૨૯૧

પ્રક્રિયા થાય, શરીરમાં નવા કોષો તૈયાર થાય, પ્રતિકાર શક્તિ વધે. હાલમાં સંશોધન થયું છે કે ૭ થી ૮ કલાકની શાંત ઊંઘ કરનાર વધુ જીવે છે. બપોરની ઊંઘ રાતની ઊંઘની જગ્યા ન લઈ શકે પણ શરીરમાં સ્ફૂર્તિ લાવે, કામની ઝડપ વધારે. શાંત, સારી ઊંઘ કરનારની ચામડી પર કરચલીઓ ઓછી પડે, ચામડી તાજગી ભરી દેખાય.

ઊંઘમાંથી ઉઠ્યા બારાબર માર્થું દુઃખવું, થાક લાગવો, નંખાઈગયા જેવું કે તાકાત ન હોય એવું લાગવું, ઊંઘમાં ૩ કે તેથી વધુ વખત ઉઠવું, ઊંઘમાં નસકોરા બોલાવવા, બડબડવું કે લાત મારવી એ અશાંત અથવા બરાબર ઊંઘ ન હોવી એવું સુચવે છે. આવું જો ૨ અઠવાડિયાથી વધુ ચાલે તો આરોગ્ય માટે હાનિકારક.

ઊંઘ ઓછી કે અશાંત હોય તો થાક લાગે, અપચન થાય, સ્ફૂર્તિ ન રહે, કામ કરવાનું મન ન થાય. વધુ દિવસ આમ ચાલે તો આપણે ચીડચીડા થઈ જઈએ, નાની નાની વાતમાં ગુસ્સે થઈ જઈએ, બી.પી. અને બ્લડસુગર વધે, યાદ શક્તિ ઘટે, આંખો આસપાસ કાળા કુંડાળા થાય, હાડકાને નુકશાન થાય, લોહીમાં ટ્રાયગ્લીસરાઈડ વધે, હાર્ટએટેક થઈ શકે, સ્તન કેન્સર થઈ શકે, નિરાશા આવે, આપઘાતની ટેન્ડન્સી વધે. સ્ટ્રેસ અને ઓછી ઊંઘ મળી બુઢાપો જલ્દી લાવે. જ્યારે ઊંઘ ઓછી થાય

ત્યારે શરીર જે રસાયણ વધુ ઉત્પન્ન કરે છે તેથી ભુખ વધારે અને વજન-જાડાપણું વધે. ઊંઘ ઓછી થાય તો ભુખનું નિયંત્રણ કરનાર, ઘટાડનાર લેપ્ટીન નામનું રસાયણ ઓછું ઉત્પન્ન થાય. ઘણાં દિવસ સુધી ઊંઘ ઓછી થાય તો મગજમાં સ્ટેરોઈડ વધી જાય તેથી મગજમાં હોર્મોનલ ઈમ્બેલેન્સ થાય અને નિરાશા ઉત્પન્ન થાય. સાવ જ ઓછી ઊંઘ કોરોનરી હાર્ટડીસીસ અને સ્ટ્રોકની શક્યતા વધારે છે.

દિલ્હીની ગંગારામ હોસ્પિટલના કાર્ડિયોલોસ્ટ ડૉ. સોલ્હની અને સ્લીપ મેડીસીનના વાઈસ-ચેરપર સન ડૉ. સમ્બીતા પાંડાના ૧૮ વર્ષ અને તેની વધુ ઉંમરના ૩૫૨ લોકો પરના અભ્યાસમાં જણાયું કે હેલ્થી લાઈફસ્ટાઈલની ટેવો સાથે ૭ કલાક કે તેની વધુ શાંત ઊંઘ કરવાવાળાને હાર્ટ અને તેની નસોની બિમારીઓ ૬૫% ઓછી જોખમી હોય છે, અને ઘાતક તકલીફોનું જોખમ ૮૩% ઓછું હોય છે. ૬ કલાક ઓછી ઊંઘ કે રાતના ૩ કે તેથી વધુ વાર ઊંઘ ઉડે તો હાર્ટએટેક અને સ્ટ્રોકની શક્યતા ૩ ગણી વધી જાય છે. આ તકલીફો જાડાપણું, હાઈ બી.પી., ધુમ્રપાન અથવા હાઈકોલેસ્ટ્રોલ જેવા રીસ્ક ફેક્ટર ન હોય તો પણ ઊંઘ ઓછી, અશાંત હોય તો, થઈ શકે, જો આ રીસ્ક ફેક્ટર હોય તો આ બિમારીઓની શક્યતા ઓર વધી જાય છે.

★ સેલ ★ SALE ★ સેલ ★ SALE ★ સેલ ★ SALE ★ સેલ ★ SALE ★ સેલ ★ SALE ★ સેલ ★ SALE ★ સેલ ★ SALE

મહાવીર (માટુંગા સે.રે.)

મહાવીર બિલ્ડીંગ કંમ્પાઉંડ, ભંડારકર રોડ, માંટુંગા (સે.રે)

દિવાળી સેલ ધમાકા

શનિવાર તા. ૫-૧૦-૨૦૧૩ થી રવીવાર તા. ૩-૧૧-૧૩

મહાવીર સ એમ્પ્રોડરી 24025070 / Mob. : 8652239537

સેલ ૨૦% થી ૫૦% ડિસ્કાઉન્ટ

- પારસી હેન્ડવર્ક, મશીનવર્કમાં સાડી અને કુર્તી
- ટેસ્ટેડ જરીની સાડી, ચાણિયા ચોળી
- બટ કસબની સાડી તથા બોર્ડર
- ઘરચોળા, બાંધણી માટે કટવર્ક, કસબ, ગોટા તથા ફેન્સીબોર્ડર
- ઢાકાઈ, પારસી, ફેન્સી નોટ, કાશ્મીરી, લખનવી, કચ્છી ભરત, દેશી ભરત, શેડો વર્ક, તાર વર્ક,
- પીટ્ટા વર્ક જેવી અનેક વેરાયટી તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપીશું.
- તમારી બાંધણી ઉપર હેદ્રાબાદી મીરર વર્ક, બાદલા વર્ક, નાકા ટીકી, તાર વર્ક, પીટ્ટા વર્ક કરી આપીશું.
- દરેક પ્રકારનું ભરતકામ તેમજ ઓલ્ટરેશન કરી મજૂરી ઉપર ૨૦% ડીસ્કાઉન્ટ.
- પ્લેઈન તથા ડાયબલ સાડીમાં અનેક વેરાયટી

સેમ્પલની સાડીઓમાં ૪૦% થી ૫૦% ડીસ્કાઉન્ટ

જુની સાચી જરીની સાડી, ચણિયાચોળી, ઘરચોળા, બોર્ડર-સેલા સારા ભાવે વેચાતા લઈશું.

દિવાળી સુધી બધા દિવસો દુકાન ખુલ્લી રહેશે.

૨૦૦૮ માં ચીકાગોની યુનીવર્સિટીનાં અભ્યાસમાં જણાયું કે ૧ કલાકની ઓધી ઊંઘ થાય તો હૃદયની નસોમાં કેલ્શીયમનું જમા થવું ૧૬૬ વધી જાય છે, જે નસોમાં પ્લેકનું કારણ બને અને તેથી હાર્ટએટેકની શક્યતા વધી જાય. નોર્વેજીઅન અભ્યાસમાં જણાયું કે ઊંઘ ન આવવાથી હાર્ટફલોર (હાર્ટ બરાબર કામ ન કરે) નું જોખમ ૩ ગણું વધી જાય છે. કેલિફોર્નિયાની યુનિવર્સિટીમાં નવા અભ્યાસમાં જણાયું કે ઓછી ઊંઘ થાય એવા પતિ-પત્નિમાં ઝઘડા વધી જાય છે અને આરોગ્ય પર અસર થાય છે.

અમેરીકાના ૧૩,૨૮૪ ટીનએજરના અભ્યાસમાં જણાયું કે જેમની ઊંઘ ૭ કલાકથી ઓછી થઈ હતી તેમણે ફ્રાસ્ટફ્રેક અઠવાડિયામાં કે વધુવાર ખાધું જેને લઘે તેમનામાં જાડાપણું જણાયું જ્યારે જેમની ઊંઘ ૮ કલાક કે વધુ થઈ અને ફળો, શાકભાજી જેવા આરોગ્યદાયક ખોરાક વધુ લેતા તેઓ વધુ નિરોગી હતા-જાડાપણું નહોતું. અભ્યાસમાં જણાયું છે કે ૫ કલાક કે ઓછી ઊંઘ લેનારને જાડાપણાની રીસ્ક ૧.૫૬ વધી જાય છે. ૬ કલાકની ઊંઘ લેનારને ૬૬ રીસ્ક વધી જાય છે. જાડાપણું ઘટાડવું હોય અને તાકાત વધારવી હોય. તો બીજા ઉપાયો સાથે ૮ કલાકની ઊંઘ લે જોઈએ. ઓછી ઊંઘની હોર્મોન્સ જેવી કે કોર્ટીસોલની માત્રામાં ખલેલ પહોંચે છે જેથી શરીરમાં ન જોઈએ ત્યાં ચરબી જમા થાય છે, લોહીમાં સાકર વધે છે. ઘણા વખત સુધી લોહીમાં કોર્ટીસોલ વધેલું રહે તો બી.પી., કોલેસ્ટ્રોલ, લોહીમા સાકર, પેટની ચરબી વધે છે, અને પ્રતિકાર શક્તિ ઘટે છે.

ઊંઘ ઓછી હોય એમની ચામડીમાં ઉમરથી પહેલા ઘરડાપણાની નિશાનીઓ આવે છે અને સૂરજના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી જે નુકશાન થાય છે તે સારા થવામાં ઓછપ આવે છે. જાન્યુઆરી ૧૩ માં કેઈએમ હોસ્પિટલના ડો. પ્રસન્ના ન્યાયાધીશ વધુ કામ અને ઓછી ઊંઘને લીધે કાર્ડિયાક એરેસ્ટથી સ્વર્ગવાસી થયા. આના પરથી સમજાય છે કે ૭-૮ કલાકની શાંત ઊંઘ કેટલી મહત્વની છે.

તાવ, શરીરમાં દુઃખાવો, ખુબ થાક, હાઈ બી.પી., હાઈ ડાયબીટીઝ, હાર્ટની બિમારીઓ, છાતીમાં દુખાવો, છાતીમાં ધબકારા વધુ ગતિથી થવા, ફેફસામાં પાણી ભરાવાથી, દમ, વધુ ગેસ, એસડીટી, અપચો, સૂતી વખતે કે સૂતાં પહેલાં પચવામાં ભારે ખોરાક લેવાથી કે, ભરપુર પાણી પીવાથી, ખાલી પેટે ઊંઘ ઓછી કે ઉડી જાય છે. બપોર ની વધુ પડતી ઊંઘ, મોડેથી ચા, કોફી લેવાથી, વ્યસન, સૂતાં પહેલાં ભારી કસરત, પેઈન કિલર્સ જેની

અમુક દવાઓ, બેચેની તાણ,ભય, નિરાશા, વગેરે માનસિક બિમારીઓમાં ઊંઘ ઉડી જાય છે. ચિંતા (ઘઘાદારીને ધંધાની ચિંતા, વિદ્યાર્થીને પરીક્ષાની ચિંતા, વડીલોને આવનાર કોઈ પ્રસંગની ચિંતા, નોકરિયાતને બોસના કડક સ્વભાવની ચિંતા) થી પણ ઊંઘ ઉડીજાય છે. આજકાલ કેરિયર બનાવવા, ધંધો વધારવા, જોખમમાં ટાર્ગેટ પૂરા કરવામાં, આપણી જરૂરીયાતો વધારી ખર્ચા પૂરા કરવામાં આપણે ઊંઘનો ધણીવાર છેદ ઉડાડીએ છીએ.

મુંબઈની હિન્દુજા હોસ્પિટલના સાયકીઆટ્રીસ્ટ ડો. કેરસી ચાવડા કહે છે કે આજકાલના જવાનો, ટી.વી. વિડીયો ગેમ્સ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન, લેપટોપના રાતના મોડે સુધી ઉજાગરાને લીધે મગજ ઉત્તેજિત હોય છે તેને લીધે તેમની ઊંઘ ઉડી શકે છે. ઓછી ઊંઘ એ ધીમા મોતની બરાબર છે. બ્રિટનની યુનિવર્સિટીનાં અભ્યાસમાં જણાયું કે જેઓને હાર્ટબર્ન (છાતીમાં બળતરા) થાય છે એમાંના ૫૦૬ રાતના ઊંઘમા ઉઠી જાય છે. પેટનું એસિડ સુઈએ એટલે અન્નનળીમાં છાતીમાં ઉપર ચડી હાર્ટ બર્ન કરી ઊંઘમા ખલેલ પાડે છે, માટે રાતે વહેલા જમો જેથી ખોરાક પચી જાય અથવા તે શક્ય ન હોય તો મોડેથી જમો તો, ધીમે ધીમે ચાવીને જમો, ૧૫ મીનીટમાં ઉતાવળે જમવાને બદલે અડધો કલાક ચાવી ચાવીને જમો. બને ત્યાં સુધી પચવામાં હલકું હોય તેવું અને તેટલું જ ખાઓ.

સ્લીપ એપનીઆ એવી બિમારી છે કે જેમાં વ્યક્તિ ઉંઘમાં ૧૦ સેકન્ડ કે તેથી વધારે સમય શ્વાસ ન લે અને તે પણ કલાકમાં પચી વધુ વખત આવું બને. મોટેથી નસકોરા બોલાવવા, શ્વાસ રોકાવા જેવું થવું, અચાનક ઊંઘ ઉડી જવી, શ્વાસ લેવા તરફડવું અને વહેલી સવારના ઊંઘ જેવું લાગવું વગેરે લક્ષણો છે. રીસર્ચમાં જણાયું છેકે આ બિમારીને લીધે ઓચિંતા કાર્ડિયાક ડેથ, હાઈ બી.પી. હાર્ટએટેક જેવી બિમારી થઈ શકે. એક રીસર્ચમાં જણાયું છે કે જેને દમની તકલીફ હોય એમને આ બિમારી થવાની શક્યતા વધી જાય છે. બાળપણથી દમ હોય એમને રીસ્ક વધુ હોય છે. સ્પેનમાં ૫૫૦૦ દર્દીઓની ઊંઘવાની આદતોની ૭ વર્ષ સુધી અભ્યાસનોંધ કરવામાં આવી જેમાં ઊંઘમાં નસકોરા બોલાવવા કે બે શ્વાસ વરચે ખુબ લાંબો સમય લેવાથી લોહીમાં ઓક્સીજનનું પ્રમાણ ૯૦૬ થી ઘટી જાય તો ડાયબિટીઝ, હૃદય રોગ, થાક, હાઈ બી.પી જેવી તકલીફ થઈ શકે અને દેખાઈ આવ્યું કે લોહીમાં ઓક્સીજનનું પ્રમાણ જેટલું ઓછું એટલું કેન્સરનું જોખમ વધારે.

ડાબે કે જમણે પડખે અથવા ચત્તા સુવું, ઊંઘા ન સુવું કેમકે ફેફસાં દબાય અને શ્વાસોશ્વાસ બરાબર ન

થાય, જેમને કમરની તકલીફ હોય એમણે પીઠ, કમરને ટેકો મળે એ માટે બંને પગ વચ્ચે તકીયો રાખી ડાબે કે જમણે પડખે સુવું. તકીયામાં ભેજઅને મૂત ચામડીના કોષોને કારણે, ફોમરબર કે સિન્થેટિક મટેરિયલવાળા ઓશિકામાં જીવાત પેદા થઈ શકે અને દમ, સાયનસ, શ્વાસોશ્વાસના રોગો થઈ શકે, આવા દર્દીઓએ વખતોવખત તકિયા તડકે સૂકવવા કે ડ્રાયસ્ટીમ કલીનર થી સાફ કરવા. ઊનનાં કે નેચરલ લેટેક્સ પિલો કુગ અને જીવાતરોધક ગણાય છે. ઓશિકા બહુ જાડા કે એકદમ પાતળા ન લેતાં એવા હોવા જોઈએ કે જેથી શરીરનું અલાઈનમેન્ટ સચવાય. આજકાલ પીઠ, કમર, ગરદન અને માથાના દુઃખાવાની અનેક બિમારીઓનું એક કારણ મુલાયમ પથારી, પોચી ગાદીવાળા પલંગ અને સુવાંળા ઓશીકાં છે. ઊંઘ પૂરી થાય, આંખ ખૂલે ત્યારે ભગવાનનું નામ લેતાં શરીરને સ્ટ્રેચ કરો, તાણો. ચત્તા સુંતા સુતાં હાથઉપર લઈ હાથને ઉપર તરફ, પગને નીચે તરફ જાતે તાણો, પછી આજ રીતે ડાબે પડખે, પછી જમણે પડખે કરો. આનાથી લોહીનું ભ્રમણ થશે, પીઠ, સાંધાના દુઃખાવામાં રાહત મળશે. બિછાનામાંથી ઉઠતી વખતે કમરની તકલીફવાળા ડાબે કે જમણે પડખે

થઈને ઉઠવું, ચત્તા સૂતા સૂતા ઉઠવાથી કમરનો દુઃખાવો વધી શકે. લો બી. પીવાળાએ, સગર્ભાએ બેડપરથી ઝટકાથી ન ઉઠતાં ધીરે ધીરે ઊઠવું.

ઊંઘમાં નીચેના લક્ષણો એક અઠવાડિયાથી વધુ ચાલે તો ડોક્ટરને બતાડવું જરૂરી : ઊંઘમાં વધુ પસીનો થાય એ ટી.બીનો સંકેત, દાતનું કચકચાવવું એ તાણ-ચિંતા દર્શાવે છે. ઊંઘની ગોળી લેવાને બદલે તાણ દુર કરો. કેફીન ધરાવતા પદાર્થો ન લ્યો, વ્યસન હોય તો ત્યજો. રાત્રે વધુ પેશાબ ડાયાબિટીઝ, પ્રોસ્ટેટ (પુરુષોમાં ગ્રંથિ) મોટી થવાનું લક્ષણ. બાળક પહેલાં ઊંઘમાં પથારી ભીની ન કરતું હોય અને પછી કરવા લાગે તો જૂવેનાઈલ ડાયબિટીઝના લક્ષણો તપાસી લેવા જોઈએ. પગમાં કેમ્પસ (નસ ખેચાંવળી) થાય તો પોષ્ટિક ખોરાક નથી લેવાતો એ દર્શાવે છે, પેશાબ વધારે એવી ગોળી લેવાથી પણ આવું થાય. લીલા શાકભાજી, કોળાના બી, કેળા, નારિયેળ પાણી, લીંબુ શરબત લ્યો. છાતીમાં બળતરા ઘણી રાતો સુધી થાય તો અન્નનળીના અંદરના પડમાં ફેરફાર અથવા પેટમાં કે અન્નનળીમાં સોજો, ગેસ્ટ્રોઈસોફેજીઅલ રીફ્લેક્સ કે હાયેટસ હર્નીઆ હોઈ શકે.

મહાવીર બંધેજ

૯૧, મહાવીર બિલ્ડીંગ કંપાઉડ, ભંડારકર રોડ,
માટુંગા (સે.રે) મુંબઈ - ૧૯. ટેલીફોન : ૨૪૦૧૦૫૯૭

બાંધણી સાડીઓનું ભવ્ય સેલ

૨૦% થી ૩૦% ડિસ્કાઉન્ટ

તારીખ : ૫.૧૦.૧૩ થી ૩.૧૧.૧૩ સુધી

શુભ પ્રસંગને દિવાલે તેવી
રંગબેરંગી બાંધણી

ફેન્સી ઉપાડા બનારસી કેપ બાંધણી

ફેન્સી જંગલો તેમજ પાટલી પાલવ

ઈટાલીયન કેપ - જોર્જટ - સામો - ગજી બાંધણી

વ્હાઈટ ગજી સીલ્ક બાંધણી પાનેતર

રીઅલ તેમજ ટેસ્ટેડ ઘરચોળા

ફેન્સી લહેરીયા તેમજ દુપટ્ટા

દિવાળીસુધી બધા દિવસો દુકાન ખુલ્લી રહીશે

Since 1984...
Lagna Deep

બી-૧૩, જ્વારામ આશિષ દેવીદયાલ રોડ,
મુલુન્ડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૮૦.
ફોન : ૨૫૬૮૦૮૦૭ (૦૨૨)



**પધારો... અસ્સલ
કચ્છીયતના આંગણે...**

**રીયલ હેન્ડ એમ્પ્રોઇડરી,
રીઅલ જરી, ચોકબંધ ઘરચોળા**

- રીયલ બટ કસબની સાડી બોર્ડર • પીટ્ટા તાર ભરતની સાડી
- કસબ અને જીક કસબની સાડી • પારસી વર્ક
- બ્રાઈડલ ચણીયા ચોળી, ડીઝાઈનર સાડી
- પાનેતર • બનારસી ઉપાડા અને ફેન્સી બાંધણી ઘરચોળાની ટેસ્ટેડ તથા રીયલ બોર્ડરો મળશે.

(એક્સક્લુઝીવ ફ્રેસ મટેરીયલ)
જુના ઘરચોળા સારી કિંમતે લેવામાં આવશે.
Mob. : 7666688881

ગુરુવાર બંધ

ઊંઘ ન આવતી હોય એમણે આ વાતો ધ્યાનમાં રાખવી: ઉઠવાનો સમય ચોક્કસ રાખો. સવારના વહેલા ઉઠો, બપોરના ન સુવું જેથી રાતે સારી ઊંઘ આવે. નિયમિત બનો. સવારના વહેલા ઉઠવાથી સૂર્યપ્રકાશ મળે, વિટામીન ડી મળે, બાયોલોજીકલ ઘડિયાલ રીસેટ થાય. મગજમાં ઊંઘનું ચક્ર ચાલુ હોય છે એને ઘક્કો લગાડો એટલે કે સમયસર સુવો, સમયસર ઉઠો. કસરત - ચાલવાનું રોજ કરો. સૂતી વખતે કસરત કે ભારી કામ ના કરો. પૌષ્ટિક આહાર લ્યો. ઓફીસના કામ ઓફીસમાં જ છોડી આવો. સાંજના ઠવાગ્યા પછી તડકો વધુ હોય તો આંખો પર પ્રકાશન પડે એ રીતે પડદા કે ગોગલ્સ વાપરો જેથી મેલાટોનીન નામનું રસાયણ શરીરમાં વધુ ઉત્પન્ન થાય જે ગાઠ ઊંઘ આવવામાં મદદ કરે છે. સાંજના સૂરજ આથમે એના ૧ કલાક પહેલાં ૫૦૦ મી.ગ્રા. કેલ્શીયમ અને ૫૦૦ મી. ગ્રા. મેગ્નેશીયમ લેવા જેથી હાર્ટરેટ નિયમિત થાય, બી.પી ઘટે, ખેંચાયેલ સ્નાયુને આરામ મળે, નસો શાંત થાય, ઊંઘ સારી આવે અને પગમાં કેમ્પસ પડતા હોય તો ન પડે. કરવાના કામનું લીસ્ટ સાંજે બનાવો. જે વિચારો તમને પજવતા હોય કે તમારી ચિંતાઓ સૂવાના ૧૦ મીનીટ પહેલા કાગળ પર

ટપકાવી લો. અભ્યાસમાં જણાયું છે કે આમ કરવાથી શરીરમાં ડોપાયાઈન નામનું મગજને શાંત કરે એવું હોર્મોન તૈયાર થાય છે જે તાણ અને બેચેની દૂર કરે. અસંતોષ, નફરત ગુસ્સો મનમાંથી કાઢી નાખો. કોઈને છેતરો નહીં. છેતરશો ત્યારે થશે કે આપણને ફાયદો થયો પણ પછી ખાસ કરીને સૂતી વખતે મન ડંખશે અને ઊંઘ નહીં આવે. કોઈએ આપણને કંઈ ખરાબ કહ્યું હોય, ગુસ્સો કર્યો હોય તો મનમાંથી કાઢી એને માફ કરી દો. આપણી ભૂલ થઈ હોય, કોઈપર ગુસ્સો કર્યો હોય તો માફ માંગી લ્યો, કાંઈનહીં તો મનથી માફ માંગી લ્યો, મન શાંત થશે, શાંત ઊંઘ આવશે. સાંજે વહેલા જમો, હળવું ભોજન લ્યો. ચા,કોફી,કોલા જેવા હળવા પીણાં સૂતી વખતે ન લ્યો. ૩ થી ૪ કલાક પહેલાં લઈ શકો. તમાકુ, ગુટકા, દારૂ જેવા ઉત્તેજક પદાર્થ બિલકુલ ન લ્યો. થાકેલા હો ત્યારે કોઈ કામ ન કરો, આરામ કરો, ઊંઘી જાઓ. બ્રાહ્મી, શંખપુષ્પી, જેઠીમધ, ગળો ચૂર્ણ સરખે ભાગે મેળવી ૫-૫ ગ્રામ સવાર-સાંજ ગરમ દુધ સાથે લ્યો. દુધમાં ૧ ચમચી ગંઠોડા (પીપરામૂળ) ચૂર્ણ નાખી પીઓ. હાઈ બી.પી ન હોય તો સાથે ૧ ચમચી અશ્વગંધા ચૂર્ણ લ્યો. બેડરૂમમાં ભડક રંગ ન હોવા જોઈએ. બહારનો પ્રકાશ ન



SHRI KDO JAIN PASCHIM EKKAM

Reg. Office : Mahendra Meghji Momaya - President

"Amit" 5- Parsana Nagar, B/h. Junktion, Rajkot - 360 001. Ph. 0281 2444703 M. 0 90997 00444.

Email : momayamm@gmail.com

સરક્યુલર નં. ૩/૧૩

૨૨-૧૦-૨૦૧૩

જયજિનેન્દ્ર સાથે જણાવવાનું કે શ્રી ક.દ.ઓ. જૈન પશ્ચિમ એકમની આગામી જનરલ મીટીંગ તા. ૦૧-૧૨-૧૩ ને રવિવારે સવારના ૧૧-૦૦ કલાકે નીચેના એડ્રેસ પર રાખવામાં આવી છે.
જ્ઞાતિ શિરોમણી શેઠ શ્રી નરશીનાથા જૈન ધર્મશાળા, પાલીતાણા

મીટીંગની કાર્યસૂચી (એજન્ડા)

૧. એકમની ૨૩-૦૯-૨૦૧૨ ની જનરલ મીટીંગ ની મીનીટ્સ વાંચનમાં લઈ બહાલ રાખવા બાબત.
 ૨. એકમના ૩૧-૩-૨૦૧૩ ના રોજ પુરા તથા વર્ષના ઓડીટિડ હિસાબ -કિતાબ.
 ૩. એકમના ૨૦૧૩-૨૦૧૪ ના વર્ષ માટે અંદાજીત બજેટ .
 ૪. એકમના ૨૦૧૩-૨૦૧૪ ના વર્ષ માટે ઓડીટરની નિમણૂક કરવા બાબત.
 ૫. શ્રી.ક.દ.ઓ. જૈન કચ્છ એકમ આયોજીત યુવા ઉમંગ ૨૦૧૩ પર ચર્ચા- વિચારણા કરવા બાબત.
 ૬. પ્રમુખશ્રી અથવા પ્રમુખશ્રીની અનુમતીથી જે કાંઈ રજૂઆત થાય તેના પર ચર્ચા- વિચારણા કરવા બાબત.
- નોંધ-(૧)કોરમના અભાવે જે મીટીંગ મુલતવી રાખવી પડે તો ઉપરોક્ત સ્થાને ૩૦ મીનીટ પછી કોરમનો બાધ લીધા વગર મીટીંગની કાર્યવાહી કરવામાં આવશે.
- (૨) ફક્ત તા. ૩૦-૧૦-૨૦૧૩ સુધી નોંધાયેલા એકમના સભ્યો માટે પ્રવેશ, સભ્યોને માત્ર પ્રકાશ સમીક્ષાના માધ્યમથી જાણ કરવામાં આવે છે, વ્યક્તિગત નોટીસ મોકલવામાં આવશે નહીં.

લિ. શ્રી ક.દ.ઓ. જૈન પશ્ચિમ એકમ વતી સેક્રેટરી મુકેશ માણેકજી લોડાયા (વડોદરા)

આવે માટે પડદા લગાડો. બેડરૂમમાં શાંતિહોવી જોઈએ. બેડરૂમમાં ૨૦° / ૨૪° તાપમાન અને ૬૦૦ થી ભેજ હોય તો ઉત્તમ. ગરમ રૂમમાં સુવા કરતા ઠંડા રૂમમાં ઊંઘ સારી આવે છે. સુખાસન, સવાસન, ધ્યાન (મેડીટેશન) મનનો થાક ઉતરે છે, સારી ઊંઘ આવે છે. ધ્યાનથી મગજમાં તરંગો વધે છે જે આનંદ, શાંતિનો ભરપુર સ્ત્રોત છે. લોમઅનુલોમ, ઉંડા શ્વાસોશ્વાસ લેવાથી સારી ઊંઘ આવે. સૂતાં પહેલાં પદમાસનમાં બેસી ત્રાટક કરવું, નજરની સામે જ્યોત, બિંદુ કે ચંત્ર પર ધ્યાન-દૃષ્ટિ (જ્યાસુથી આંખમાં પાણી આવે અથવા પાપણ બંધ થાય ત્યાં સુધી) કેન્દ્રિત કરવી. આંખોની તકલીફ વાળા એ ન કરવું (તેમણે અનુલોમ-વીલોમ ભ્રામરી પ્રાણાયામ કરવા) એનાથી મન શાંત થાય છે, ઊંઘ સારી આવે છે. સ્પ્રે બોટલમાં ૨ કપ પાણીમાં ૨૫ ટીપાં લવેન્ડર ઈસેન્સીઅલ ઓઈલના નાખી સુતાં પહેલાં ઓશિકાકવર, ગાદલાપર સ્પ્રે કરો. ૨૦ મિનિટ સુધી ઊંઘ ન આવે તો ઉઠો અને થોડીવાર માટે સાફ વાંચન કે હળવું સંગીત સાંભળી ફરી ઊંઘવા પ્રયત્ન કરો.

કર્મવીરની વિદાય



ચંપક રાયચંદ જીવાણી

દેવશરણ સોમવાર તા. ૩૦.૯.૨૦૧૩

કચ્છી દશા ઓસવાલ જ્ઞાતિના મુઠી ઊંચેરા માનવી સહૃદયી ચંપકભાઈ આપની અણધારી વિદાયે સમસ્ત જ્ઞાતિએ, આપના પરિવારે અને મેં મારા શ્રેષ્ઠ મિત્રને ગમાવતાં આ આઘાત જીરવવો અમારા સૌ માટે વસમો રહેશે.

જ્ઞાતિ આપની વિચાર ધારાને અનુસરે અને આપની ભાવના ઓને એજ ચરિતાર્થ કરે અભ્યર્થના.

પરમ કુપાળુ પરમાત્મા આપ જેવા ધર્માત્માને પરમ શાંતિ અર્પે એજ પ્રાર્થના .

- લક્ષ્મીચંદ લાલજી પોલડીયા (લ.લા.પો)

એડીનબર્ગ સ્લીપ સેન્ટર અને સાઉન્ડ સ્લીપ ના લેખક ડો. કિસ ઈઝીકોવા સ્કિ કહે છે આપણે સૂતા હોઈએ ત્યારે શરીરમાંથી હાથ, ચહેરા અને પગના પંજાઓ દ્વારા ગરમી બહાર જાય છે અને તે લગભગ વહેલી સવારે ૪ વાગ્યા સુધી બહાર નીકળવાનું ચાલુ હોય છે. આ શરીરના તાપમાન ઘટવાની પ્રક્રિયામાં કાંઈપણ અડચણ આવે તો ઊંઘ બગડે છે. આના માટે બેડસીટ કુદરતી ફાયબરનું હોય તો ઉત્તમ. ફોમની કે સિન્થેટીક મટેરીયલની મેટ્રેસ હોય તો તેની પર કોટનની બેડશીટ નાખી સુવું, કોટન કે સીલ્કના ઢીલા નાઈટડ્રેસ પહેરી સુવાથી કુદરતી રેષા પસસીનો ચુસી લેશે. સંકોચાઈને સુવા કરતાં ફેલાઈને સૂવાથી પણ શરીર ઠંડુ રહેશે અને ઊંઘ સારી આવશે. જો ગરમી, બાફ કે પસીનાથી આકુળવ્યાકુળ થઈ ઊંઘ ન આવતી હોય તો ઠંડા પાણીએ નાહી કે હાથ અને કાંડા નળના ઠંડા પાણી નીચે થોડી મીનીટ રાખવા અને પછી સૂકાય એટલે સીધા સૂવા જવું.

ઓફીસના, ધંધાના કે બીજા કારણે મન પર તાણ થતી હોય તો તાણ મન પર લેવી કે નહી? કેટલી લેવી અને તાણ લઈને પ્રા હલ થશે કે? એનો પ્રત્યેક વિચાર કરવો. સગાસંબંધીઓના લીધે, મન પર તાણને લીધે આપણે નકારાત્મક વિચારો તો નથી કરતાને એ જુઓ. કાલના કામની ચિંતામાં આજની રાત બગાડવી અને બીજા દિવસે અત્યંત વિસ્મયકારક પરિસ્થિતિમાં કામ કરવું ક્યાં સુધી ઉચિત છે એ વિચારવું. આપણે આપણા કર્મ કરવા, બાકી ભગવાન પર છોડવું ઉત્તમ છે. ઊંઘ ન આવે તો બાહ્ય ઉપચાર કરતાં ગોળીઓ વગેરે લેવા કરતાં આપણા મન પર સારો ઉપચાર કરવો જરૂરી છે. મનને સારા વિચારની ટેવ પડે એ બધા કરતાં રામબાણ ઈલાજ છે. કોઈનું ભલું કરવાથી પણ સારી ઊંઘ આવે. શરીર મહેનતથી થાકે અને મનમાં શાંતિ, સંતોષ, સમાધાન હોયતો ચોક્કસ ઊંઘ આવે. શુદ્ધ, સાફ મન જેવું કોઈ ઓશીકું દુનિયામાં નથી. આપણાથી બનતી મહેનત કરી, બાકીનું ભગવાન પર છોડી, મનમાંથી કપટ, છેતરપીંડી, વધુ પડતો સ્વાર્થ, વેરઝેર કાઢી સંતોષ સમાધાનથી દિવસ વિતાવીએ તો વગર ઓશીકે બાળકની જેમ ઊંઘ આવે. સાતેક કલાકની શાંત ઊંઘ કરો અને ઘણી બિમારીઓથી બચો.



મહાન તીર્થ સુથરી

પર્વા ધિરાજ પર્યુષણ મહાપર્વ પ્રભુજીની છાયામાં આરાધના કરવા હું અને મારી ધર્મપત્ની સુથરી તીર્થ ગયા હતા. અમારી જીંદગીનો મહાન યાદગાર અનુભવ અમને અહીં મળ્યો. અમે સુથરી ગામનાં નથી એવું એક ક્ષણભર અમને અનુભવ ન થયો આ તીર્થમાં અમને મળ્યા પુ. સાધવીશ્રી મહાયશાશ્રી સૌમ્ય તપસ્વી અને વાંચન કરનારા. સાથે અમને મળ્યા મહાન શ્રી કિર્તીભાઈ, શ્રી જીતુભાઈ, શ્રી અશોકભાઈ શ્રી ભરતભાઈ અને બહેન કાંતાબેન જેમણે અમને પ્રભુજીની આરાધનો કરવામાં અને અન્ય કાર્યો કરવામાં સાથ અને સંગાથ આપ્યો. સુથરી મહાજન અને ટ્રસ્ટીઓને અમારી ખૂબ ખૂબ અનુમોદન.

દામજી ત્રીકમજી ધરમશી જસાપર - મીરાસોડ

ધાર્મિક વરઘોડા હોય યા ભાવના તબલચી તબલાઓ ઉપર થાપી મારી નાદ પ્રગટાવતા હોય તો ભેડઓ પખાવાજની જોડ લઈ એક તાલમાં વગાડી મોટેથી સ્તવનોની હારમાળ રજૂ કરી ભક્તિનો માહોલ ખડું કરતા હોય, પખાવાજમાં જોડાવું યા તેમને સાંભળવું એ અનેરો લહાવો છે.

હવે પખાવાજ વિસરાતું જાય છે. નજીકના ભૂતકાળમાં શ્રી દીપક ગંગાજર ડાઘા (વરાડીયા) એ સાંજીના ગીતો યા પખાવાજમાં ગવાતા ગીતોની નાનકડી પૂસ્તિકા બહાર પાડી પખાવાજ ચાહકોને આનંદિત કર્યા. ખેર, આ પર્યુષણમાં કચ્છ કોઠારા મધે શ્રી કુંવરજી નરશી પટેલ (લોડાયા) ના ઘરે મહાવીર સ્વામી પારણાના જાગરણ બાદ બીજા દિવસે પરોઢીયે પ્રભાતિયાંની વેળા પખાવાજનાં કલરવથી ગુંજી ઊઠ્યો. આનંદ આનંદ થઈ ગયો!

કાંતિલાલ કેશવજી મોતા - મુલુંડ (૫)

શોક પ્રદર્શનમાં કરકસર

શોક પ્રદર્શન મોટ શોક-સભા યોજાય છે તે બારામાં મારું સુચન છે તે પ્રમાણે થાય તો ઘણાજ ખર્ચા બચી શકે છે.

અમારે ત્યાં નાગપુરમાં જે થાય છે તેમાં એક રૂપીઆનો ખર્ચો થતો નથી જે પણ લખાવનું હોય તે પોતાની શક્તિ પ્રમાણે.

હોલનું ભાડું લાગતું નથી જે અત્રે ઉપાશ્રયમાં થાય છે દરેક દેહેરાશરમાં ત્રણે ઠેકાણે ઉપાશ્રય છે ઉપાશ્રયવાળા ભાડું લેતા નથી તમારી તરફથી જે પણ શક્તિ પ્રમાણે રૂ. ૫૧ આપી પણ થઈ શકે છે.

પ્રાર્થના માટે વીશા સમાજ પણ પોતનો હોલ આપે છે. ત્યાં પ્રાર્થનાંની ચોપડીયો છે તેમાંથી પ્રાર્થનામાં આવેલ ભાઈઓ નવકાર મંત્ર બોલી પછી તેમ જે પણ યોગ્ય લાગે તે ૪-૫ પ્રાર્થનાઓ બોલી પુર્ણ કરે છે. ભાઈઓ અગર બહેનો ૩-૪ જણ પ્રાર્થના બોલે પછી બાકી બેઠા હોય તે (પ્રાર્થના ને જીલાવે) એજ પ્રાર્થનાનું ફરીથી બોલ એ પ્રમાણે ૪-૫ પ્રાર્થના બોલે. એ પછી સમાજમાંથી જે પણ પ્રમુખ અગર ભાઈ એના વિશે જે પણ એના ગુણગાન બોલે તે ૨-૩ ત્રણ મીનીટ બોલે પછી એના તરફથી જીવદયા - અગર સંસ્થા માટે કંઈ દાન જાહેર કરવું હોય તે જાહેર કરે પછી શોકસભા પુર્ણ થઈ જાહેર કે અને પછી બધા જે સગા સંબંધી નજીકના હોય તે લાઈનમાં ઉભા રહે પછી હાથ જોડી પુર્ણ કરે. આ વિધી કલાકની છે. ૧૫ મીનીટ માટે સમાજના જે પ્રમુખ - ઉપપ્રમુખ - ખજાનચી જે ૫-૧ જણ હોય તે ભેગા બેસી શોક જાહેર કરી તે કમીટીવાળા શોક સંદેશનો લેટર સમાજવાળા એમોકલે એ વિધી પુર્ણ થાય.

એકીજ રાતે તપગચ્છ સંઘમાં એટલે દરાસરમાં ઉપાશ્રમાં અમે જઈએ તો ત્યાં ભાડું લાગતું નથી ત્યાં પણ શાંતિ મોટીબોલી પછી સાધુ સાધ્વિજી હાજર હોય. તે એમના માટે પથી ૧૦ મીનીટ બોલે અને જેની પ્રાર્થના હોય તેમના નજીકના રહે અને બાકી બધા હાથ જોડી ઊભા રહે. જો દાન જાહેર કરવું હોય તો તે જાહેર કરે એટલે કોઈ પણ પાર્ટી કે સંગીતવાળાને બોલાવવાની જરૂરત રહેતી નથી.

બાકી મુંબઈમાં અડધા-પોણા કલાકમાં બધા આવી શકે નહીં એટલે ૧ થી ૧૫૫ કલાક જોઈએ. તો પ્રાર્થના ૪-૫ નાં અથવા રાતે ૮ થી ૧૦ યા તે સમયમાં જેટલી બોલાય તેટલી બોલરી જેથી સમય સચવાઈ જાય.

નાગપુરમાં પૈસાવાળા હોય કે મધ્યમ વર્ગના હોય બધા આ પ્રમાણેજ ચલાવે છે. બાકી આપણા ઉપાશ્રય કે હોલ હોય તે સમાજ માટે ફ્રી રાખવા જોઈએ જેથી મધ્યમ વર્ગનું તો ભલું થઈ શકે.

પૈસાવાળાઓને એ પોસાય તેમ નથી. એમને બધું સાફ દેખાવવું જોઈએ તોજ કામ થાય તેમ છે.

લી. મેઘજી લાલજી શાહ - નાગપુર ગુજરાત સમાચારની પૂર્તિ

ગુજરાત સમાચારની પૂર્તિ, ધર્મલોક વાંચી રહ્યો હતો, વાચતાં વાંચતાં પ્રભાવના શબ્દ આગળ દૃષ્ટિ થંભી ગઈ, વિચાર આવ્યો આ પ્રભાવના શબ્દ જૈન જગતમાં બહોળા પ્રમાણમાં બોલાય છે. અન્યમાં પ્રસાદી, સુખડી કે કહાણી શબ્દનો ઉપયોગ થાય છે.

આ પ્રભાવના શબ્દના મથાળા નીચે કચ્છી દશા ઓશવાલ જ્ઞાતિના એક એવા વ્યક્તિનું નામ હતું કે જેને વાંચી રહેજે પણ ગર્વ થાય. એ વ્યક્તિ હતા શ્રી ભવાનજી અરજણા ખીમજી (કચ્છ).

આચાર્યશ્રી વાત્સલ્યદીપ સૂરિજીએ ઉલ્લેખ કર્યો હતો કે ભારતમાં ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના સંવિધાન (બંધારણ) લાગુ થયું. સંવિધાન સભા લગભગ ત્રણ વર્ષ (૨ વર્ષ, ૧૧ મહિના અને સત્તર દિવસ) કાર્યરત રહી. સંવિધાન સભામાં ૫ સભ્યો હતા: તેમાં ૦૬ જૈન સભ્યો હતા: ૧. શ્રી અજીત પ્રસાદ જૈન,

સહરાનપુર, ૨. શ્રી બલવંત મહેતા, ઉદયપુર ૩. શ્રી ભવાનજી અરજણા ખીમજી, કચ્છ ૪. શ્રી કુસુમકાંત જૈન, ઈંદોર ૫. શ્રી રતનલાલ માલવીય, સાગર ૬. શ્રી ચીમન લાલ ચકુભાઈ શાહ, સૌરાષ્ટ્ર, આમ છ જૈન સંવિધાન સભામાં હતા.

આમ આ થઈ અનાખી પ્રભાવના! જેને વાંચી સહેજે નત મસ્તક ગૌરવથી ઊંચે થઈ જાય આવા કે.ડી.ઓ. વ્યક્તિને સત સત પ્રણામ - વંદના!!

૧૩/૧૦/૧૩ આણંદ ડો. ઠાકરશી મૈશેરી

પ્રકાશ-સમીક્ષાના જાહેરાત દર

પ્રકાર	સાઈઝ	કલર	બ્લોક-વ્હાઈટ
આખું પાનું	160 x 225 mm	7,000	4,000
અડધું પાનું	160 x 111 mm	4,000	2,250
પા પાનું	77 x 111 mm	2,500	1,250
૧/૮ પાનું	77 x 54 mm	-	700
૧/૧૬ પાનું	77 x 27 mm	-	350

ચેક C.D.O. PRAKASH SAMIKSHA ના નામે લખવા

ફટાકડા શા માટે ફોડવા જોઈએ ?????

 **દામજી ચત્રભુજ ધરમશીનાં ઉલટા ચરમાં !** 

કચ્છ ગામ - સાંચરા, હાલ - મુલુંડ(વે).

૧. શાંતીથી ચણતા પંખીડાઓને ફટાકડા ફોટી તેમને ચણવા ન દેતા તેમને ઉપવાસ કરવવામાં સહભાગી થવા માટે ?
૨. અસ્થમાં અમે અન્ય બિમારીમાં પીડાતા દર્દીઓની પીડામાં ફટાકડા ફોડીને વધારો કરવા માટે ?
૩. સીનીયર સિટીઝનોને આરામમાં ભંગ પાડી આશીર્વાદ મેળવવા માટે ?
૪. પારણામાં ઝુલતા બાળકોને ફટાકડા ફોડીને નીંદરમા ખલેલ અને ભય સાથે ડરાવવા માટે ?
૫. આપણાં લાડકવાયા બાળકને ફટાકડા ફોડતી વખતે અકસ્માત થતા અપંગ બનાવવા અથવા ચિર વિદાય પમાડવા માટે ?
૬. વાતારવણમાં હવામાં અને અવાજનું પ્રદુષણ ફેલાવી ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરવા માટે ?
૭. ખૂબજ મોટા પ્રમાણમાં વાયુકાયનાં જીવોની હિંસા કરવા માટે ?
૮. ફટાકડા ફોડીને કોઈના પણ ઘર કે દુકાન સળગાવી દેવા માટે ?
૯. ફટાકડા ફોડીને આપણીજ કમાણી (રૂપિયા) નો ઘુમાડા ખેવા માટે ?
૧૦. ખુબજ શરમજનક વાત બાબત : અહિંસાનો સંદેશો આપનાર તિર્થંકર શ્રી મહાવીર સ્વામીના નિર્વાણદિને ફટાકડા ફોડીને (હિંસા કરીને) શ્રદ્ધાંજલી અર્પણ કરવા માટે ?

ઉપરનાં સુવાક્યો (કટાક્ષિકા) આપને યોગ્ય લાગેતો ફટાકડા ફોડીને લાભ લેવો કે ન લેવો એ નિર્ણય આપનાં હાથમાંજ છે.

સગપણ સેતુ

સગપણ સમસ્યા હળવી કરવા આપના સંતાનની માહિતી નીચે દર્શાવેલ ફોર્મ મુજબ મોકલો. એ પરિચય ઉપરથી પસંદગીનો ક્રમાંક લખી જણાવી અમને આપના સંતાનનો બાયોડેટા મોકલો. એ વિગત આપના પસંદગીના ઉમેદવારના પરિવારને જણાવીશું. કુંડલી-ફોટા અમને મોકલવા નહીં. પત્રવ્યવહાર માટે જરૂરી પોસ્ટેજ કવર સાથે મોકલવા વિનંતી છે. સીધે સીધી માહિતી કોઈને અપાતી નથી. આપ ઈચ્છો તો આપના સંતાનની માહિતી નીચે દર્શાવેલ ફોર્મ મુજબ જ કોલમવાર ભરી મોકલો અને સગપણ સેતુમાં ભાગ લો.

ક્ર.	માહિતી પત્રક	૫૫૧	૫૫૨	૫૫૩	૫૫૪	૫૫૫	૫૫૬
૧	સ્ત્રી કે પુરૂષ	પુરૂષ	પુરૂષ	પુરૂષ	સ્ત્રી	પુરૂષ	પુરૂષ
૨	નુખ/અટક/ઓળખ	છેડા	ધુલ્લા	દંડ	લોડાયા	ધરમશી	છેડા
૩	જન્મ તારીખ	૧૬.૦૫.૭૮	૦૮.૦૯.૮૭	૨૬.૦૧.૮૮	૨૪.૦૯.૮૮	૦૯.૦૫.૮૬	૦૨.૦૫.૮૮
૪	વય (વર્ષ)	૩૫	૨૬	૨૫	૨૪	૨૭	૨૫
૫	ઉંચાઈ (સે.મી.)	૫'-૮''	૬'-૨''	૫'-૭''	૫'-૦''	૫'-૯''	૫'-૬''
૬	વજન (કી.ગ્રા.)	૭૦	૮૦	૫૨	૪૦	૫૫	૫૫
૭	વાર્ણ	ઘઉંવાર્ણ	ગોરો	ઘઉંવાર્ણ	રૂપાળી	ઘઉંવાર્ણ	ઘઉંવાર્ણ
૮	શિક્ષણ/અભ્યાસ	H.S.C.	S.S.C	B.Com.	T.Y.Bcom.	B.E.(Chem)	M. Pharm
૯	નોકરી/ધંધો	નોકરી (સેલ્સમેન)	નોકરી	નોકરી	નોકરી	નોકરી	નોકરી
૧૦	હાલ વસવાટનું ગામ	ડોંબિવલી	ઠાકુલી	ડોંબિવલી	મુંબઈ	વડોદરા	બેંગલોર
૧૧	પાત્રના શોખ	ક્રિકેટ	ક્રિકેટ-પ્રવાસ	-	-	સ્પોર્ટ્સ	વાંચન-પ્રવાસ
૧૨	ખોડખાંપણ	નથી	નથી	નથી	નથી	નથી	નથી
૧૩	માસિક આવક (રૂ.)	૪૫૦૦૦	૧૫૦૦૦	૧૮૦૦૦	૧૨૦૦૦	૫૦૦૦૦	૨૫૦૦૦
૧૪	અવર/વિ/છુટાછેડા	છુટાછેડા	અવર	અવર	અવર	અવર	અવર
૧૫	કુંડલીમાં માનો છો ?	ના	ના	હા	હા	હા	હા
૧૬	મંગળ/શનિ છે ?	ના	ના	ના	હા	ના	હા
૧૭	ફોટો મળશે ?	હા	હા	હા	હા	હા	હા
૧૮	સામેના પાત્રનું અપેક્ષિત શિક્ષણ	સુશિક્ષિત	સુશિક્ષિત	ભાણેલી	-	ગ્રેજ્યુએટ	પોસ્ટ ગ્રેજ્યુએટ
૧૯	તમારી પાત્ર અંગે વિશેષ પસંદગી/અપેક્ષા	સુશીલ-સંસ્કારી મિલનસાર	સુશીલ-સંસ્કારી મિલનસાર	સંસ્કારી મિલનસાર	મિલનસાર-સંસ્કારી	સુશીલ-સંસ્કારી	સંસ્કારી-ભાણેલી સ્ત્રીમ
૨૦	ઉમેદવારની ખાસ વિશેષ માહિતી	સશીલ-સંસ્કારી પરિવારપ્રેમી	સુશીલ-સંસ્કારી મિલનસાર	સંસ્કારી મિલનસાર	મિલનસાર	મિલનસાર પરિવારપ્રેમી	પરિવારપ્રેમી મિલનસાર
૨૧	સીધો સંપર્ક ઈચ્છતા હો તો ફોન નં.(સ્વૈચ્છિક)	9819728821	7350119846	9833312616 9833312335	9820153562 9321558008	09925752967	

આ વિભાગમાં ભાગ લેવા કાર્યાલય માટે નીચેની વિગત ભરી મોકલવી જરૂરી છે. (નીચેની માહિતી અપ્રકટ રહેશે.)

મોકલનાર વાલીનું નામ : _____ ઉમેદવારનું નામ : _____

સરનામું : _____

ફોન : _____

૭મા અધિકૃત વ.પ. ના કુટુંબ ક્રમાંક : _____ સહી : _____

When mutual fund distributor Bajaj Capital found that a certain investor had not made any new investments in mutual funds for a long time, it decided to check up on him. To their surprise, the officials found that the investor had died a few years ago and his wife had no knowledge about the Rs. 2 lakh he had invested in HDFC Mutual Funds. "The amount had grown to Rs. 9-10 lakh. The lady broke down because she was facing financial difficulties and the money would help her tide over the problems," says Surajit Misra, executive vice-president and national head of mutual funds, Bajaj Capital.

Ajay Kumar Parmar had forgotten all about the Saradar Sarovar Narmada Nigam bonds he had bought 20 years ago when he was living in Ranchi. It was only when he heard about

HOW TO AVOID THIS SITUATION

Follow these tips to ensure that your investments don't go unclaimed.

NOTE IT DOWN

Make a file where you note the details of all your investments. Pen down all relevant folio and account numbers.

KEEP FAMILY IN LOOP

Inform your spouse and other family members about all financial transactions. In this way, you ensure that even if something happens to you, your family will be able to access your investments.

ASSIGN A NOMINEE

Mention a nominee in all financial investments. This ensures that the funds are transferred to the nominee without any hassle.

REMIND YOURSELF

Set up reminders for premium payments and maturity dates of investments. This can be done through various websites, your PC and even through mobile phones.

GO FOR ECS

Give ECS mandates for direct credit of dividends, interest payments and maturity proceeds into your bank accounts.

END THE CLUTTER

Close down bank accounts you don't use, transfer PF to the new employer and avoid having too many mutual funds and insurance policies. The fewer the investments, the easier they are to track.



another investor getting a good price for his bonds this year that he recalled his own investment.

Not everyone is as lucky though. An estimated Rs. 22,000 crore of investors' wealth is lying unclaimed with insurance companies, mutual funds, corporate houses, banks and the Employees' Provident Fund Organisation. These are investments that were made but never claimed by the owners after maturity. "The investors who put small amounts in a number of instruments often face this problem because the

દંડ તથા મોતા પરિવારનું ગૌરવ



ચિ. હર્ષ પ્રકુલ દંડ

BACHELOR OF INFORMATION TECHNOLOGY

ચિ. હર્ષ ઈજીનિઅરિંગમાં ફર્સ્ટ ક્લાસ ડિસ્ટિંગ્શનમાં પાસ થયો છે. તે એમજ ભાવિ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એજ હાર્દિક શુભેચ્છા...

-: શુભેચ્છક :-

શ્રીમતી હીરબાઈ નરશી દંડ, હૈદરાબાદ
શ્રીમતી હંસા પ્રકુલ દંડ, હૈદરાબાદ
કુ. વૈશાલી પ્રકુલ દંડ, હૈદરાબાદ
તથા સમસ્ત મોતા પરિવાર, મલકાપુર

portfolio becomes too unwieldy and difficult to monitor," says Sandeep shanbhag, director at Wonderland consultants Tax & Investment Advisory.

ET Wealth looked at the unclaimed wealth lying across various investment options. Insurance policies and longterm instruments top the list of most forgotten investments. It's a problem that affects almost every investor. Every household will have a dormant bank account, or a long-forgotten insurance policy or expired dividend cheques. In the following article we tell you how you can reclaim this money.

LIFE INSURANCE POLICY

Rs. 1,724 crore worth of unclaimed funds of policyholders are lying with life insurance companies. These include death claims not filed.

How to Claim it : *If you have the policy numbers and documents, claiming the maturity benefit is not a problem. You should approach the branch where the policy was bought. If you are staying in a different city, approach the zonal officer or get help from an agent to get the money back.*

BANK ACCOUNTS AND DEPOSITS

Rs. 1,739 crore is lying unclaimed in more than 1 crore bank accounts and fixed deposits.

How to Claim it : *It's fairly easy if you have the FD receipt, savings bank passbook or the account numbers. Just take it to the bank branch, along with a photo identification proof. It can be an uphill task if the claimant does not have the required documents or proof or being the legal heir.*

STOCK INVESTMENTS AND DIVIDENDS

Rs. 800 crore unpaid dividend had been transferred to the investor Education and Protection Fund till 2010-11.

How to Claim it : *Write to the company or to its registrar and share transfer agent, giving details of the missed dividends, stock folio number and the date of purchase. Give bank details for direct transfer. You can also ask for a duplicate dividend warrant.*

INCOME TAX REFUNDS

Rs. 1,300 crore of tax refunds are pending in the Karnataka Goa circle alone.

How to Claim it : *If you filed an e-return, write to the Bangalore CPC with your e-filing acknowledgement number. If*

you filed physical returns, approach the PRO of the ward with the details of the return.

MUTUAL FUND INVESTMENTS

Rs. 453 crore worth of unpaid dividends and unclaimed assets are lying with mutual funds.

How to Claim it : *Write to the fund house, mentioning the folio number, The agent can be of help here. Note that signature mismatches can prove problematic. If the investor is no more, his nominee will have to submit proof of identity.*

PROVIDENT FUND

Rs. 16,000 crore lying unclaimed in some 3 crore dormant PF accounts.

How to Claim it : *Fill up the PF transfer form in triplicate and submit it to your present employer. One copy of the form is sent to the regional provident fund commissioner, another to your old employer for transferring the fund and one is kept by your present employer. Withdrawal of funds will need another form, which too would be available with your employer or at the regional PF office.*

POST OFFICE INVESTMENTS

Of the total 1.55 lakh Post Office branches in the country, only 24,015 are computerised. The rest depend on manual record keeping of investments.

How to Claim it : *It is easy to reclaim the money if you have the passbook or the certificates. However, you will have to visit the post office branch where the account was opened. Unfortunately, earlier records are not computerised and you may have to cajole the staff to look up old registers. If the investor is no more, his nominee or legal heir will get the funds only after completing the required, lengthy paperwork.*

BONDS

The demat option was introduced in October 1996 with the setting up of the NSDL. Before that, all securities were issued in the physical form.

How to Claim it : *Approach the issuer or its registrar and share transfer agent. If you have the original bond certificate, it is easy. Otherwise you should have the folio number or the bond number. Your bank account number or a cancelled cheque may be needed.*

**Courtesy : The Economic Times WEALTH
Cover Story May 21-27 -2012 Issue**



Shree Samasta Kutchi Dasa Oswal Jain Mahajan श्री समस्त कुच्छी दशा ओशवाल जैन महाजन

ओફिस : કે/ઓ. તન-મન ટુર્સ, સેકેટરી જનરલ, ૧૯/૨૦ ભુજબળ નિવાસ,
જવાહરલાલ નેહરુ રોડ, મુલુંડ વેસ્ટ મુંબઈ - ૪૦૦ ૦૮૦. ફોન : ૨૫૯૦૩૫૧૪ / ૧૫/૧૬ ઈમેલ : samastamahajan@yahoo.com

તિથી - તારીખ ફેલેન્ડર - ૨૦૧૪

જય જિનેન્દ્ર

જ્ઞાતિજનોજોગ,

ગત વર્ષની જેમ આ વર્ષે પણ તીથી - તારીખ સાથેનું જ્ઞાતિના જિનાલયો અને અન્ય વિશિષ્ટ માહિતીપ્રદ, અચલગચ્છીય સમાચારીને અનુરૂપ ૧૨ પાનાનું આર્ટ પેપર પર રંગીન આકર્ષક કેલેન્ડર જ્ઞાતિ દાતાઓને સહયોગે પ્રસિધ્ધ કરવામાં આવશે.

જ્ઞાતિ એકતા, જ્ઞાતિની એક ઓળખ ને અનુરૂપ એક જ્ઞાતિ એક કેલેન્ડર જ જ્ઞાતિ સ્તરે પ્રસિધ્ધ થાય તે માટે ગત વર્ષે પણ પ્રયાસ કરાયેલ અને એને સુંદર પ્રતિસાદ પણ પ્રાપ્ત થયેલ. પણ ગત વર્ષે શરૂઆત હતી. મોડા પડયા હતા. એક થી વધુ કેલેન્ડરો પ્રસિધ્ધ પણ થયા, પણ આ વખતે એક જ કેલેન્ડર પ્રસિધ્ધ થાય અને તેમાં સૌનો સંપૂર્ણ સહયોગ મળી રહે એ માટે આપના દ્વારા અપાયેલ કૌલ ને યાદ આપાવવા ફરી એકવાર આ જાહેર વિજ્ઞાપ્તિ દ્વારા આ અપીલ કરીએ છીએ.

માહિતી રસપ્રદ, સચોટ અને ઉપયોગી બની રહે તે માટે આપના સુચનો-સલાહ-માર્ગદર્શન માત્ર આવકાર્ય જ નહીં બલકે અનિવાર્ય છે. તો ઝડપ કરશોજી.

જા. ખ મર્યાદિત લેવાની હોઈ ઉપરાંત ગત વર્ષના સહયોગીઓ માંથી મોટા ભાગના ફરીથી જા.ખ આપવા ઉત્સુક હોવાથી થોડાજ નવા નામ લઈ શકાય તેમ છે જોકે જુના સહયોગી પોતે ઈચ્છે છ કે નવા નામો ઉમેરાય તો પોતે હટી જવાની તૈયારી સુઝા દર્શાવેલ છે. આ તક ઝડપી લેવા નવા સહયોગીઓને આમંત્રણ છે.

વિનંતી કરવાની કે વ્યક્તિગત રીતે કે સંસ્થાઓ દ્વારા આવા પ્રકારના કેલેન્ડરો પ્રસિધ્ધ કરવાની ભાવના હોય તો તેમણે જ્ઞાતિ એકતા ધ્યાનમાં રાખીને સ્વતંત્ર કેલેન્ડરો પ્રગટ કરવાનું હવે થી બંદ કરી, આપની વ્યક્તિગત - સંસ્થાની ઓળખ જા.ખ.રૂપે સમસ્ત ના કેલેન્ડર માં છપાવી આપ પોતાની આ પ્રવૃત્તિ આડકતરી રીતે ચાલુ રાખો તે ઈચ્છીનીય છે. આ રીતે આપ આપની ઓળખ સાથે જ્ઞાતિ એકતા - અસ્મિતા ને પણ સમર્થન આપી શકશો !

કેલેન્ડર ની સાઈજ ૪૪ સે.મી. X ૪૨૯ સે.મી રહેશે

જા.ખ માટેનો નકરો	ક્યાં	પ્રીન્ટિંગ એરીયા
15000/- 11000/- 25000/-	ઉપરની તરફ નીચેની તરફ ઉપર-નીચે બન્ને એક સાથે	26 c.m. x 7.5 c.m. 26 c.m. x 5 c.m.

ઉક્ત નકરો આપ રોકડેથી કે પછી D.D., PAY ORDER અથવા સમસ્ત મહાજના અરિહંત બેંક ના ખાતામા સીધા જમા કરાવી શકશો.

જ્ઞાતિના પ્રીન્ટરોને અપીલ

ઉપર દર્શાવ્યા મુજબના કદના સારી ક્યોલીટીના જાડા આર્ટ પેપર પર મલ્ટીકલર પ્રીન્ટીંગના લગભગ ૭૫૦૦/- કેલેન્ડરો છાપી આપી, જ્ઞાતિ મૈયાની સેવાની આ તક ઝડપીલેશોજી આપને કોટેશનો બંધ કવર મા તા. ૧૦ નવેમ્બર સુધી અમને કાર્યાલયે મળી રહે તે મુજબ મોકલી આપવા નિમંત્રણ છે.

કોટેશન આપતી વખતે સુંદર સફાઈદાર, ક્ષતિરહિત આકર્ષક મુદ્રણ, પેપરની ક્વાલિટી અને સમયબધ્ધતા સાથે સાથે આ પૈસા જ્ઞાતિજનો ના છે. એ ધ્યાનમાં રાખશોજી એવી વિનંતી.

સેકેટરી જનરલ
ચીમન મોતા

સૌ જ્ઞાતિજનોને દિવાવલી પર્વની હાર્દિક શુભેચ્છાઓ



શ્રી સ્વસ્તિક ગ્રુપ

ડોંબિવલી આયોજિત

ચૈત્ય પરિપાટી તા. ૨૦ થી ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩

આ છે દિલેર દાતાઓ, લાભદ્રીધા સવાયા, એવા લાભેણા દાતા પરિવારો....

મુખ્ય દાતા

માતૃશ્રી તારાબેન માણેકજી મોતા (રાપરગઢવાળી) Jash Mercantile LLP
માતૃશ્રી ચંપાબેન હંસરાજ પરબત ડાદા (વરાડીયા) Amba Shipping Agency
માતૃશ્રી ખમાવંતીબેન ચિમનલાલ ખોના (મોટી ખાવડી) S. M. Services

સહયોગી દાતા

માતૃશ્રી પુષ્પાબેન પાશ્ચીર નાગડા (રંગપુર)
માતૃશ્રી મણીબેન જેતશી ગોવિંદજી દંડ (સેવકભરડીયા)

સાધર્મિક ભક્તિના દાતા

પહેલો દિવસ :

- નવકારશી - એક સદ્ ગૃહસ્થ
બપોરના જમવાના - માતૃશ્રી નવલબેન મણીલાલ દંડ (સેવક ભરડીયા)
ચા-પાણીના - ગાં. સ્વ. રંજનબેન અશોક દંડ (સેવક ભરડીયા)
ચૌવિહારના - ગાં. સ્વ. હંસાબેન ભરત મુલજી લોડાયા (આરીખાણા)
(હસ્તે : સોમચંદ ઠાકરશી ધરમશી - સેવક ભરડીયા)

બીજો દિવસ :

- નવકારશીના - એક સદ્ગૃહસ્થ
બપોરના જમવાના - કુ. શાલ્વી મીના શૈલેષ ખોના (મોટી ખાવડી)
ચા-પાણીના - માતૃશ્રી પ્રભાવંતીબેન મુલજી લોડાયા (સેવક ભરડીયા)
ચૌવિહારના - અ. સૌ. લક્ષ્મીબેન સોમચંદ ઠાકરશી ધરમશી (સેવક ભરડીયા)

સહ-સહયોગી દાતા

માતૃશ્રી સોનબાઈ જેઠાલાલ લાપસીયા (દલતુંગી), માતૃશ્રી મણીબેન કુંવરજી મોતા (સાંધવ), માતૃશ્રી જયાબેન મોતીલાલ લોડાયા (મોટી ખાવડી), માતૃશ્રી સોનબાઈ દામજી માલદે (દલતુંગી), માતૃશ્રી નવલબેન જેતશી શિયાલ (દલતુંગી), એક સદ્ગૃહસ્થ

સંઘપૂજનના દાતા

માતૃશ્રી તારાબેન નવિનચંદ્ર ધુલ્લા (સે.ભરડીયા), માતૃશ્રી તારાબેન માણેકજી મોતા (રાપરગઢવાળી)

પૂજાની કીટના દાતા

- નેર - શ્રીમતી પુષ્પાબેન જયંતભાઈ ખોના(તેરા),
બલસાણા - અ.સૌ. તારાબેન નવિનચંદ્ર ધુલ્લા (સે.ભરડીયા),
બલસાણા (પદ્માવતીદેવી) - શ્રીમતી હીના ગરીશ ડાદા (દલતુંગી),
ડોંડાઈયા - માતૃશ્રી ધનલક્ષ્મીબેન હંસરાજ ધરમશી (સેવક ભરડીયા),
પારોલા - શ્રીમતી હેમલતા વિજય ધરમશી તથા ગાં. સ્વ. લતા રમેશ ખોના,
પાંચોરા - શ્રીમતી દિવ્યાબેન વિશનજી નાગડા (સે.ભરડીયા),
અમલનેર - શ્રીમતી લતાબેન હીરાચંદ છેડા (વારાપધર), ધુળિયા - એક સદ્ગૃહસ્થ



જ્ઞાતિના સ્પર્શતા સમાચારો ટૂંકમાં પાનાની એક બાજુએ સારા અક્ષરે કાર્યક્રમ પૂર્ણ થાય કે તરત લખી મોકલવા વિનંતી.

સાંઘવાસીઓ અને શાંતિ ગ્રુપની રાજસ્થાન યાત્રા

સાંઘવાસીઓ તથા શાંતિગ્રુપના કાર્યકર મળી ૬૨ જણે રાજસ્થાન યાત્રા કરેલ.

તા. ૧૦-૧૦-૨૦૧૩ ના રાત્રે ટ્રેન દ્વારા રવાના. સવારના નવકારશી ઉઝા સ્ટેશન ઉપર, શૈલેશભાઈ દેવજી દોલત પરિવારે લાભ લીધેલ. આબુ સ્ટેશનથી બસ દ્વારા રવાના થઈને દંતાણી તીર્થ પહોંચેલ. ત્યાંથી નહાઈ ધોઈ સેવા પૂજા કરી બપોરના સઘાર્મિક ભક્તિનો લાભ શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપે લીધેલ. ત્યાંથી ભેરૂતારક તીર્થમાં દેવદર્શન કરી, કેવલબાગ દેવદર્શન કરી ચા પાણીનો લાભ માતુશ્રી મણીબાઈ કલ્યાણજી લોડાયા આરીખાણાવાળાએ લીધેલ. ત્યાંથી પાવાપુરી જિનાલય તરફ પ્રયાણ ત્યા ચૌવિહારનો લાભ શ્રી ચાંપશી માણેકજી લોડાયા લોખંડવાલા પરિવાર સાંઘવાલાએ લીધેલ.

રાત્રી રોકાણ ભીનમાલ તીર્થ સવારના ૧૧-૧૦-૨૦૧૩ ના સવારના બઉતેર જીનાલયના દેવદર્શન પૂજા કરી સવારના નવકારશી માતુશ્રી મણીબાઈ કુંવરજી મોતા સાંઘવાળાએ લીધેલ ત્યાંથી ભિનમાલમાં, રિધ્ધી-સિધ્ધી પાર્શ્વનાથજિનાલય, મહાવીર સ્વામી જિનાલય, સાનમાળનો કીર્તી સ્તંભ જિનાલય, રાણિવાળામાં સંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય દેવદર્શન કર્યા બપોરના સાધર્મિક ભક્તિનો લાભ માતુશ્રી જમકુબાઈ પટેલ સાંઘવાળાએ લીધેલ. ત્યાંથી વિજયપતાકાતીર્થ, વરમાળા તીર્થ ત્યાં ચા-પાણીનો લાભ, તેમજ જીરાવલાતીર્થ દેવદર્શન

કરી ચૌવિહારનો લાભ શ્રી શાંતિજિન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈએ લીધેલ.

રાત્રી રોકાણ દંતાણી તીર્થ રાત્રે પ્રભુમની ભક્તિ ભાવનામાં ફાલ્ગુન ખોના, પંકજ દંડ, કાંતિલાલ લાલકા, પારસ મૈશેરી, નવિન મૈશેરી, અમીત મોમાયા, ગીતા લોડાયા, જયશ્રી ખોના, જ્યોતીબેન લાલકા એ સારી એવી રમજટ જમાવેલ તેમાં ત્રણ: સાડીના લકકી ડ્રો રાખવામાં આવેલ, તેમનો લાભ તથા આરતીનો લાભ પંકજ સુરેશ દંડ (અપેક્ષાસાડી) એ લીધેલ.

તા. ૧૩-૧૦-૨૦૧૩ના સવારના દેવદર્શન પૂજાપાઠ કરી નવકારશીનો લાભ દિનેશ કેશવજી લોડાયા આરીખાણાવાળાએ લીધેલ. ત્યાંથી આબુતીર્થ તરફ પ્રયાણ ત્યાં તળોટીના બે જિનાલયના દર્શન કરી માઉન્ટઆબુ દેલવાડા તેમજ અચલગરછના દર્શનકરી બપોરના આબુ સ્ટેશન આગમન. ત્યાં બપોરના ચા અને સાંજના ટ્રેનમાં ચૌવિહારનો લાભ શ્રી સંઘવી શ્રી ભાગચંદ દામજી જૈને લીધેલ. દરેક દાતાશ્રીઓ તરફથી ટ્રેનમાં ૧૯૦ રૂપિયાનાં સંઘપુજન, વિવિધ પ્રકારના ૧૦ આઈટમોના નાસ્તાના પેકેટ બસમાં. શ્રી ઠાકરશી લાલજી પટેલએ લાભ લિધેલ. બસમાં વિવિધ ગેમી તેમજ ધાર્મિક પ્રશ્નોત્તરી રમાડવામાં આવી. તેમાંપણ દાતાશ્રીઓ તરફથી ઈનામ આપવામાં આવેલ.

આકર્ષક પેકેજ રૂ. ૧૦૦માં
બલીચ, ફેસિયલ, મેનીક્યોર, પેડીક્યોર,
ઓઈલ મસાજ, હરપેક, વેક્સીંગ, આઈ બ્રો,
અપર લીપ્સ, ચીન.
સંપર્ક : ૯૦૨૨૧૫૯૦૨૨ , ૯૫૯૪૫૨૨૨૨૭

લગ્નસરાની સાડીઓમાં કેડીઓ જ્ઞાતિનું વિશ્વસનીય નામ

અવસર સાડીઝ

- સાચી/ટેસ્ટેડ કસબ અને જીંક કસબ સાડીઓ, ચણીયા ચોલી.
- રીયલ/ટેસ્ટેડ ઘરચોળા, બોર્ડરો, પાનેતર, બાંધણીઓ તથા ફેન્સીવર્ડ સાડીઓ.

૧, રૂપલ અપાર્ટમેન્ટ, દાદા સાહેબ ફાલકે રોડ,
દાદર (ઈ), મુંબઈ - ૧૪. ટે. ૨૪૧૬ ૪૨૩૯

સંપર્ક: દિનેશ દેટિયા - 92234 25676

શ્રી ક.દ.ઓ. પોલડીયા પરિવારો જોગ

ગૌરાગં બાલુડો (ગોએરસમા, બારોઈ, બાયઠ, રંગપુર, લુણી ડુમરા)

આયોજીત કચ્છ ઘણીયાણા માં આશાપુરા માતાજીની પંચમ પહેડી તા. ૧૨-૧-૨૦૧૪ રવિવારના રોજ શેઠ શ્રી નરશી નાથા સભાગૃહ (એ.સી હાલે) અનંતસિધ્ધી ભાંડુપ મધ્યે યોજલે છે. તો આપ સૌ પોલડીયા પરિવારો સહકુટુંબ તથા આપણી નિયાણીઓ પણ સહકુટુંબ પધારશોજી.

આપને ભાવભર્યુ આમત્રણ પાઠવતાં
અમો અત્યંત હર્ષ અનુભવીએ છીએ.

પંચમ પહેડીના સૌજન્ય ઠાતા

માતુશ્રી વેલબાઈ વરેશી લઘાબાઈ પોલડીયા - બાયઠ
માતુશ્રી રતનબાઈ વલેજી આણંદજી પોલડીયા - બાયઠ

એજલિ આપના ભવકીય

ગૌરંગ બાલુડો પોલડીયા પરિવારોની સમિતિ વતીથી
લક્ષ્મીચંદ લાલજી પોલડીયા - દીપક દામજી પોલડીયા
ના જય માતાજી

બાયઠ ગામના પોલડીયા પરિવારો જોગ

આપણા માદરેવતન બાયઠ ગામમાં માં આશાપુરા માતાજી તથા માં મોમાય માતાજી બીરાજમાન છે. સંજોગવશાત બંને જગ્યાએ ભુવાજીનું સ્થાન ખાલી છે.

આગામી એપ્રિલ માસમાં તા. ૧૩-૪-૨૦૧૪ થી તા. ૧૫-૪-૨૦૧૪ સુધી ત્રિ દિવસય (ચૈત્ર શુદ્ધ તેરસ, ચૌદશ - પુનમ) કાર્યક્રમ ભુવાજી બનાવવાનું આયોજન કરેલ છે.

આ પ્રસંગે આપ સૌ પોલડીયા પરિવારોને સહ-કુટુંબ બાયઠ તા. ૧૧-૪-૨૦૧૪ સુધી પધારવાનું ભાવભર્યુ આમત્રણ પાઠવીએ છીએ.

પરિવાર જનોએ ફરજીઆત આવવાનું છે તે ધ્યાનમાં રાખશો.

વિગતવાર સંપૂર્ણ કાર્યક્રમ આપને આજરોજ પત્ર દ્વારા મોકલાવેલો છે. મલેથી જવાબ પાઠવશોજી

સંપર્ક: શ્રી ગુલાબ વરેશી પોલડીયા : ૯૯૭૫૩૨૭૭૨
શ્રી યોગેશ હીરાલાલ પોલડીયા : ૯૮૬૯૩૩૮૮૦૮
શ્રી નીલેશ મેઘજી પોલડીયા : ૯૯૨૫૮૫૩૬૮૦

એજ લિ.

શ્રી મેઘજી રામજી પોલડીયા • શ્રી વેલજી લાલજી પોલડીયા
ના જય માતાજી વાંચશો

દરેક તીર્થમાં સેવા પૂજા, સમુહ ચૈત્યવંદનનો લાલ લીધેલ. દંતાણી તીર્થના મેનેજર ભરતકુમાર આશારીયા દંડએ રાજસ્થાન યાત્રાનું મેનેજમેન્ટ કરેલ.

આકોલામાં મહામંગલકારી શ્રી ધર્મચક્ર-વ્રત સમાપન મહોત્સવ

અત્રે શ્રી આદિનાથ જિનાલયમાં પ.પૂ શ્રી દર્શનવલ્લભ વિજયજી મ.સા. અને સાધ્વી શ્રી સુયશ પ્રજ્ઞાશ્રીજીની પાવન નિશ્રામાં ૮૨ દિવસની શ્રી ધર્મચક્ર-વ્રત આરાધનાનો સમાપન મહોત્સવ ભાદરવા વદ તા. ૨૯-૯-૨૦૧૩ થી યોજાયેલ. શ્રી દશાન્હિકા પ્રભુભક્તિ મહોત્સવ, દસ દિવસનો મહામહોત્સવ ઉજવવા બહારગામથી પણ ભાવિકો પધારેલ ૮૨ દિવસ સુધી ચાલેલ આ વ્રત ની આરાધનામાં ૭ વર્ષથી ૮૨ વર્ષનાં લગભગ ૨૦૦ તપસ્વીઓ જોડાયા હતા.

આ દરમ્યાન શ્રી પંચકલ્યાણક પુજા, શ્રી શાલીભદ્ર અનુષ્ઠાન, શ્રી શત્રુંજય મહાતીર્થની ભાવયાત્રા, શ્રી પંચ નમસ્કાર મહાપુજનની તથા દસ દિવસ સુધી સકળ સંઘનું સ્વમિવાત્સલ્ય રાખવામાં આવેલ. આ ધર્મચક્ર વ્રતોનો લાભ લેનાર. સૌ. સરલાબેન મણીલાલ લાપસીયા. રમીલાબેન ચાપસી ધરમસી અને શ્રી કીશોરભાઈ પુનશીભાઈ ખોનાએ.

આસો સુદ ૨ તા. ૬-૧૦-૧૩નાં તપસ્વીઓની ભવ્યભવ્ય રથયાત્રા ૧ થી ૧.૫. કી. લાંબી ૫ કી.મી. નો પંથ કરી મહોત્સવ સ્થળ સુધી નિકળી હતી. શોભા યાત્રામાં પં.પુ. સાધુ તેમજ પ. પુ. સાધ્વીજી પણ જોડાયા હતા. આકોલા સંઘના શ્રી આદીનાથ જિનાલયના ૧૦૯ વરસના ઈતિહાસમાં પ્રથમવાર આનું ઐતિહાસિક મહોત્સવ ભવ્ય ગૌરાન્વિત આયોજન કરેલ.

ભાંડુપમાં સિદ્ધચક્ર પૂજન

ગુરૂદેવોની નિશ્રામાં રાપરગઢવારીના શ્રી કુંવરજી હરશી લોડાયા પરિવારમાં સ્વગ્રહે ચાર

ચાર અઠ્ઠાઈના આરાધક હોતાં સિદ્ધચક્ર પૂજન ભણાવી ભવ્ય સાંજ રાખી અનુમોદના કરાવાઈ. રનેહીજનોની ભરચક હાજરીએ ઉપસ્થિતો એ પરિવાર ને શુભેચ્છાએ નવાજી જીવદયામાં રૂ. ૩૬૦૦૦/- ફાળો નોંધાવ્યો પરિવારે ૫૫૦ જણની સ્વામીભક્તિ કરી.

શ્રી ક.દ.ઓ. જેન જ્ઞાતિ મહાજન મુંબઈ આયોજન નિ:શૂલ્ક ચૈત્ય પરિપાટીમાં ૭૦ જણ જોડાઈ અનંતનાથ જિનાલય ઘાટકોપર દર્શન કરી મહાજન આયોજીત સમુહ સાંજ માં ભાગ લીધો. વાસી મુકામે. આ. ભ. કાલપ્રભસાગર સૂરી મ.સા.ને વંદનાકરી તથા થાણામાં પૂ.સા.શ્રી હિતપ્રજ્ઞાશ્રીજી મ.સા.ને વંદનાકરી ચૌવિહાર કરી મુલુન્ડ ઈસ્ટમાં ગણીવર્યા પૂ. મુનિ શ્રી કવીન્દ્રસાગરજી મ.સા.અને વેસ્ટમાં પ.પૂ સા શ્રી વિપુલગુણા મ.સા. આદીને વંદના કરી જિનાલયોને જુહાર્યા હતા.

ભા. સુ સાતમના ૫૫ ભક્તો પગપાળા મુલુન્ડ જઈ વાસુપુજ્ય દાદાને જુહારી ગૂરૂ ભગવંતો પાસે ક્ષમા-ચાચના માંગી ખમાવેલ. પૂ.સા.શ્રી સૌમ્યગુણાશ્રીજી મ.સા.ને. વંદયા. મુલુન્ડ વેસ્ટ ગયા.

રવીવાર તા. ૨૯ના સવારના શ્રી સંઘે પૌષધવૃત્ત આદરેલ બાળકો તથા શ્રવીકા મળી ૪૫ જણો ભક્તામર ભાષ્ય અનુષ્ઠાન પૂર્ણ કરેલ.

પ. પૂ. સાધ્વી. શ્રી તીર્થેશ ગુણાશ્રીજી મ.સા.અને સા. શ્રી કૃતાર્થગુણાશ્રી મ.સા.ના અથાક પરિશ્રમ-લગન સુઝ બુઝથી તૈયાર કરેલ નાટિકા આદેશ્વર દાદા જન્મ કલ્યાણક મહોત્સવ અ.સૌ. ગીતા લહેરચંદ લોડાયા ના નેતૃત્વમાં ૧૦ કલાકારોના કાફલે ચેતનાં હરીયા એન્ડ પાર્ટીના સંગીતે, અતિ ઉલ્લાસે સંપન્ન થયો. વનીતાબેન માર્ણોકજી લોડાયા. ચેતના કીર્તી હરીયાએ અયોધ્યા નગરીના રંગમંચનો પરદો ખેંચતા સંગીતની શૂરાવલીએ હર્ષ તાળીયોના તાલે જન્મ

અસલ કલા-કસબનો સમન્વય

જી ઉચ્ચૌત્તિ સિક્ક સાડી એમ્પોરીયમ
Sachi Jari maate real nam

સાડીઓ • ચણીયાઓની • ઘરચોળા • બોર્ડરો
 પાનેતર • બાંધણીઓ મનભાવન ડીઝાઈનો,
 શ્રેષ્ઠ ક્વાલિટી અને વ્યાજબી ભાવ...

૧૩૪/૩૬, બીજે માળે, ઝવેરીબજાર, ખારાકુવા સામે,
 મુંબઈ- ૦૨. Tel. : 22413995 / 22402786

શુભેચ્છાસહ.....

શ્રી હીરાલાલ હંસરાજ ડાઘા (માટુંગા-વરાડીયા)

અંબા શીપીંગ એજન્સીઝ

૪૦૧, રાજગોર ચેમ્બર્સ, ૯૯ મસ્જીદ સાઈડીંગ રોડ, મુંબઈ-૯.

કલ્યાણક ઉજ્જવાયો. નયન કિરીટ લોડાયા, તોરલ કુમારભાઈ દંડ, નયના નરેશ મૈશેરી અનીલ કમલેશ લાપશીયા નિરવ મહેન્દ્ર મોતા.

અમીત મોમાયા, ઘૈર્ય નરેશ મૈશેરી, આરજુ દિપ્તન લોડાયા, ગુલાબ પોલડીયા, હર્ષ દાનેશ લોડાયા, સિધ્ધાર્થ ચેતન લોડાયા, નમ્ર પંકજ ગોસર, દયચંતી ભરત પટેલ અને હેતલ મણીલાલ ખોના અદિયે વિવિધ ભુમિકા ભજવી.

શ્રી સંઘે બપોરના સ્વામી ભક્તિ તથા સાંજે ચૌવિહારની વ્યવસ્થા રાખતાં ૧૬૯ જણો લાભ આપ્યો. ફાઈવ સ્ટાર કેટરીંગે સુંદર વ્યવસ્થા જાળવી.

અમરાવતી મહિલા મંચ

ઓગષ્ટ મહીનાની અમરાવતી મહિલામંચની મિટીંગ પ્રમુખ શ્રીમતી વિમલાબેન શામજી છેડાના અધ્યક્ષ પદે શ્રીમતી ધનલક્ષ્મીબેન નાગડાના ઘરે મળી હતી.

જલગામ મઘે એકમની મીટીંગ વિશે ચર્ચા કરવામાં આવી હતી. છુટા છેડા વિષે બધાએપોતાના વિચારો જણાવ્યા.

સ્નાત્ર પુજાવિષેના પ્રશ્નપત્રમાં શ્રીમતી વિમલાબેન છેડા ને પ્રથમ ઈનામ, અ.સૌ. તોરલબેન ભરતભાઈ મહેતાને અ.સૌ. દયમંતીબેન ધરમશીને ત્રીજું ઈનામ આપવામાં આવેલ.

**અંક ૩૭ તા. ૭ થી ૧૩ સપ્ટેમ્બર ૧૩ માં
ભૂલસુધાર પાના નં. ૯
વ્યક્તિ વિશેષમાં ઉમેરવાનું**

શ્રીયુત મણીકાંતભાઈ મેઘજી મોમાયા હાલ નીચે મુજબની સંસ્થાઓમાં કાર્યરત છે:

પ્રમુખશ્રીરૂપે : ૧. શ્રી કચ્છી મિત્ર મંડળ - હૈદરાબાદ, ૨. શ્રી કચ્છી દશા ઓશવાલ જૈન જ્ઞાતિ મહાજન - હૈદરાબાદ, ૩. હૈદરાબાદ - સીકંદરાબાદ Twin Cities Catering Association,

ઉપપ્રમુખરૂપે : શ્રી દક્ષીણ ભારત ક.દ.ઓ. જૈન એકમ - બેંગલોર, ૧. મેનેજીંગ ટ્રસ્ટીરૂપે શ્રી અચલગચ્છ જૈન સંઘ હૈદરાબાદ.

ટ્રસ્ટીરૂપે : ૧. સત્યમ શીવમ ગૌશાળા - હૈદરાબાદ, ૨. રોગી સહાયતા ટ્રસ્ટ - હૈદરાબાદ, ૩. ફાઉન્ડર ટ્રસ્ટી કચ્છી કો. ઓપ. કેડીટ સોસાયટી બેંક. હૈદરાબાદ

સખીવૃંદ - પુના, વાર્ષિક સામાન્ય સભા

વૃંદની વાર્ષિક સામાન્ય સભા તા. ૨જી ઓક્ટોબરના વુડલેન્ડ હોટલમાં યોજાઈ. રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજીના જન્મદીવસ નિમત્તે એમની યાદ તાજી કરી. પૂ. દેવકાબેન મહેશ્વરીના દેહાંત બદલ એમને સ્મરણાંજલિ અર્પણ કરાઈ.

સખીવૃંદના લોગો ની અનાવરણ વિધી કમીટીના સભ્યાએ કરી. લોગોની ડીઝાઈન વંદના ધરમશીએ કરી હતી. લોગોની સાથે એક ઉદ્દેશસૂત્ર સમન્વય, સહ્યોગ, સંવાદ છે. આ વર્ષે સખીવૃંદને ૨૦ વર્ષ પૂરા થયા. તેની ખૂશાલીમાં સર્વે ભૂતપૂર્વ પ્રમુખના હાથે કેક કંટીંગ કરાયું. મંડળની શરૂઆત ૧૯૯૩ માં પૂ. વિજ્યાબેન દેવજી નાગડએ કરી હતી, જેઓ આજપર્યંત મંડળમાં જોડાયેલ છે, અને તન-મન ધનથી સાથ સહકાર આપે છે. એની નોંધ લેવાઈ

મનાદ મંત્રી શ્રેતા ડાઘાએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો. ખજાનચી વંદના ધરમશીએ હિસાબની સમજણ આપી. વર્ષ દરમ્યાન લીધેલ મીટીંગમાં શ્રેષ્ઠ મિટીંગ બદલ સ્વર્ચાચતમાં વિજ્યા ખોના કોમલ ધરમશી તેમજ સ્વર્ચોજિત હીના રતાણીને ટ્રોફી તથા અન્યોને પ્રોત્સાહક ઈનામો આપવામાં આવ્યા. બધી મીટીંગમાં હાજરી આપનાર કાંતાબેન ધરમશી, મોહીની શાહ, હીના રતાણીને ભેટ અપાઈ. ૨૦ વર્ષની યાદગીરી રૂપે વૃંદની સર્વે સભ્ય બહેનોને મંડલે ભેટ આપી.

સલાહકાર તરીકે કમીટીમાંથી વિદાય લેતાં મીરાંબેન મોમાયાને સન્માનિત કર્યા. તેઓએ સૌનો આભાર માન્યો. રીટાભાટેને પ્રમુખની ટ્રોફી આપી એમનું ગૌરવ કર્યું.



શુભેચ્છાસહ.....

Laxmichand Dharshi Mota

MOTA SHIPPING AGENCY

C.H.A.No.11-0404

શુભેચ્છાસહ.....

શીતલ કોટન ટ્રેડર્સ

શ્રી કાંતિલાલ ગાંગજી વોરા પરિવાર

(રંગપુર-કોઈમ્બતુર)

આગામી બે વર્ષ માટે નવી કમીટીની નિમણૂક નીચે મુજબ થઈ. સલાહકાર રીટા ભાટે, પ્રમુખ વંદના ધરમશી, ખજાનચી: શ્રેતા ડાઘા, માનદ મંત્રી પુષ્પા લોડાયા, તેમ જ સભ્ય કલ્પના લાપસીયા અને મોતા લાલકા નિયુક્ત થયા. રીટા ભાટેઓ સર્વેનો આભાર માન્યો. બેઠકનું સંચાલન કલ્પના લાપસીયા તથા વંદના ધરમશીએ કર્યું.

શ્રી ભગવતી મહાકાલી મંડળ હુબલી

ભગવતી મંડળના નવરાત્રી ઉત્સવ દરમિયાન દરરોજ રાત્રે બેકલાક સુધી દરેક સ્ત્રી પુરૂષને પોતાના મધુર સ્તવનો ગાવાનો લાભ મળે છે તે દરમિયાન અડધો કલાક વિવિધ હરીફાઈઓનું આયોજન તથા સરપ્રાઈઝ ગીફ્ટ દ્વારા સૌને આકર્ષિત કરાય છે.

દરરોજ ભાવિકજનો તરફથી આરતીનો લાભ લેવામાં આવતો હતો. આઠમની મુખ્ય ૬૫૧ મણની ધૂતની શ્રીમતી કુસુમબેન ચીમનલાલ મોમાયા એ લાભ લીધેલ.

હરીફાઈની વિગતો આ મુજબ હતી રંગપુરો હરીફાઈ : ઉમ્મ પથી ૧૦ વર્ષ, પ્રથમ: આદીત્ય દેવાંગ મોમાયા દ્વિતીય : દેવ નિલેષ શાહ

મહિલા મંચ ગદગ

મહિલા મંચ ગદગના વર્ષ ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪ અને ૨૦૧૪-૧૫ માટે નીચે મુજબનાં પદાધીકારીઓની નિમણૂક થઈ હતી. પ્રમુખ શ્રીમતી મલ્યાકુમારી કુમારપાળ લાલકા ઉપ-પ્રમુખ શ્રીમતી દીપિકા જયેશ શાહ, કાર્યદર્શી : શ્રીમતી દિપ્તી મૌનેશ લુઠીયા, સહકાર્યદર્શી : શ્રીમતી શિલ્પા ગિરિશ નાગડા, ખજાનચી : શ્રીમતી દક્ષા સુધીર સોની

મહિલા મંચ તરફથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૫ મી ઑગસ્ટ ૨૦૧૩ નાં અત્રેના દેરાસરના ધ્વજ મહોત્સવ નિમિત્તે રાષ્ટ્રીય ધ્વજ, ધર્મ ધ્વજ તથા દેરાસરની ધ્વજ-એમ ત્રણ જાતના ધ્વજ દોરવાની સ્પર્ધા યોજવામાં આવી હતી.

આ વર્ષે શ્રી ક.દ.ઓ. જૈન મહાજન - ગદગ એ પર્યુષણ પર્વ રૂડી રીતે ઉજવવા માટે આયોજન કરવાની સંપૂર્ણ જવાબદારી મહિલા મંચને સોંપી હતી. પર્યુષણ પર્વ દરમિયાન સાથિયા અને ગહુલીની, સ્તુતિ બોલવાની, પ્રભુજીની આંગિ ભરવાની વગેરે સ્પર્ધાઓ અને રોજનીશીનું આયોજન કરવામાં આવ્યું હતું.



શેઠ શ્રી નરશી નાથા જૈન બાલાશ્રમ-નલિયા ના ભૂતપૂર્વ છાત્રો જોગ



શેઠ શ્રી નરશી નાથા જૈન બાલાશ્રમ-નલિયા નાં ભૂતપૂર્વ છાત્રો જોગ નિવેદન છે કે, બાલાશ્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મેળાવો (જાન્યુઆરી/ફેબ્રુઆરી ૨૦૧૪ માં) યોજવાનું વિચાર છે.

એમાં બહોળી સંખ્યામાં સામેલ થવા ભૂતપૂર્વ છાત્રોને આવાહન છે.

છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પોતાના નામો નીચેના સરનામે નોંધાવવા વિનંતી છે.

વિનિત

કલ્પેશ માણેકજી મોતા

૨૦, કાપડિયા ચેમ્બર્સ, ૫૧, દેવજી રતનશી માર્ગ, મસ્જીદ (પૂર્વ), મુંબઈ - ૪૦૦ ૦૦૯.

ફોન : ૦૨૨-૪૪૨૨ ૯૧૦૦ (ડીમ્પલ ખોના)

સંપર્ક સમય

સવારના ૧૧.૦૦ થી સાંજે ૫.૦૦

રાત્રે ભક્તિભાવના દરમિયાન જ્ઞાન પાંચમનો મહીમા (નાટિકા), ધાર્મિક કિવઝ, પાર્શ્વ શંખેશ્વરા દે દે થોડા સાથ (સમુહ નૃત્ય) ધાર્મિક અંતાક્ષરી (પ્રાયોજક: શા. લખમશી લઘાભાઈ નાગડા પરિવાર) કમોં કરેલા મને નડે છે (નૃત્ય નાટિકા) વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાન માટે ઉપયોગી ચીજોનું વિતરણ નાના વિદ્યાર્થીઓ બાળકોને કરવામાં આવ્યું હતું. મહાજનશ્રી દ્વારા આયોજિત સન્માન સમારંભ કાર્યક્રમનું સંચાલન શ્રીમતી દક્ષા સુધીર સોનીએ ખૂબ સરસ રીતે કર્યું હતું.

૫. પુજ્ય સાધ્વી શ્રી દિવ્યકીરણાશ્રી આદી ઠાણા ૩ ની નીશ્રામાં શ્રી ક.દ.ઓ. જૈન સંઘ (મહાજન) વતીથી નલીયા (કચ્છ) માં થતી ચાતુર્માસ આરાધના (મા. સૂદ પુનમ અચલગચ્છાધિપતિ પ.પુ.આ.ભશ્રી ગુણોદય સાગર સુરેશ્વર શ્રી મ.સા.ના. ૮૨ માં જન્મોત્સવ નિમિત્તે દેશાવગાસિક સામાયીક સહ ગુરુવંદનામા શાસન સમ્રાટ અચલગચ્છાધિપતિ પ. પુ. આ શ્રી ગુણસાગર સુરેશ્વરજી મસાનો ૩૫ મી સ્વર્ગ રોહણ, તીથી નિમિત્તે અહમ તપ તથા સહ ગુણ પુન આસો શુદ્ધ સંઘ તરફથી અનુષ્ઠાન પુજન. આસોસુદંર નાં નમીઉણ અનુષ્ઠાન શ્રીમતી વિજયાબેન અશોકભાઈ મોમાયા તરફથી થઈ. આસોમાસની શાશ્વતી આસોશુદ્ધ ૧ થી ચાલુ છે. જેના દાતા નવલભાઈ જીવરાજ લોડાયા (હુબલીવાલા) તથા સંઘ માતા સરલાબેન લક્ષ્મીચંદ નાગડા ઘાટકોપર વાલા છે. જેમાં તપસ્વીઓ સારી સંખ્યામાં આચલજી તપ કરી રહ્યા છે. પુજ્ય મ.સા. બપોરે ૩ થી ૪ સિધ્ધચક્રની બાસએય દ્વારા આરાધના કરાવી રહ્યા છે. બાળકો માટે હર શનિવારે શિબીર ચાલુ છે. બપોરના સમુહ સામઈક થાય છે આસો સુદ ૮ આઠમના ૩થી ૫ ખુબજ સારી રીતે અને સારી સંખ્યામાં

અચલગચ્છાધિષ્ઠાચિકા મહાકાલી માતાની ભાવના ભણાવવામાં આવી હતી. આસોવદશમના પુજન.

કલકતા - કચ્છી મહિલા મંડળ

શ્રીમતી ગુણવંતીબેન લક્ષ્મીચંદ લુઠીયા

દ્વારા સંગમાતા બની કચ્છની યાત્રા થે ગયા કુલે ૨૦ બેહેનો જોડાયા. ખુબજ સુંદર વ્યવસ્થા તેઓ કરી, જગ્યા જગ્યા એ ગરમ જમવાનું ચા કોફી બીસલેરી પાણી વગેરે સુંદર આયોજન, અમો એ કંઠી પર મોટી પંચતિથી, નાની પંચતિથી કરી તેમજ સૌ સૌ ના દેવસ્થાન પણ કર્યા. ગાડીમાં જતા વખતે સંઘ માતા તરફથી ધાર્મિક ગેમ રાખી હતી જેમાં ઈનામ નં, ૧. મીરાબેન મોતા ૨. નયનાબેન ને મળ્યું રેવતી બેન તરફથી પણ ધાર્મિક ગેમ હતી જેમા ૧. મીરાબેન ૨. જયશ્રી બેન ને ઈનામ મળ્યું રેવંતાબેન તરફથી ચાંદીના ગોલ્ડ પેલ્ટીયમ વાળા ગેણેશજી, બદામ અને પાઉચ ૨. ચાંદીના ગેણેશજી ગોલ્ડ પેલ્ટીનવાળાને પાઉચ આપવા માં આવ્યું, સંઘ માતા તરફથી રોકડા રૂ. નો કવર હતું.

દુંડામાં ગોગરી પરીવારે જમવાનું લાભ લીધો, સંઘ માતાનું બહુમાન કર્યું મોટી ખાખરમાં મંજૂલાબેને જમાડવાનું લાભ લીધો. સુથરીમાં વિજયાબેન ધુલ્લા એ લાભ લીધો ૨ જિનાલયમાં શુશીલા બેને જમાડવાનું લાભ લીધો, નવાવાસમાં કસ્તુરીબેને ખુબજ સારી સરભરા કરી અને ત્યાંના સંઘ તરફથી નવકારશી હતી, તેરામાં મીરાબેન તરફથી નવકારસી હતી, નયના બેને પોતાના ગામમાં શેરડીનો રસ પીવડાવ્યો જખખોમાં, મીઠી છાસનો સ્વાદ માણ્યો તેમજ પરજાઉમાં રેવંતીબેન તરફથી ચા. કોફીનો લાભ લીધો બધાએ રૂ.૧૦ની પોત પોતાના ગામમાં પ્રભાવના કરી. ગાડીમાં અંતાક્ષરી રમ્યા વચાવચ્છ કરવામાં, યાશીકા, પ્રભા, કિર્તી અન્ને નયનાએ સારો ભાગ ભજવ્યો.

યાત્રા પ્રવાસ ક્ષેત્રે આધુનિક પ્રણાલીકાઓના પ્રણેતા...



9323360708/25903514-5-6
tanmantravels@yahoo.co.in
www.tanmantour&travel.com

દિવાળીની તૈયારી એટલે આપણે ઘર દુકાન આદિની સફાઈ કરીએ છીએ, આની પાછળ નેગેટીવ એનર્જીને બહાર કાઢીને પોઝીટીવ એનર્જી માટે જગ્યા કરવાનો ઉદ્દેશ્ય છે તે આપણે સમજવું જોઈએ.

- તળ-મળ પરિવાર

શીખરજીની સર્વ પ્રથમ અને એકમાત્ર આપણી પોતાની
★★ જેવી સુવિધાયુક્ત AC હોટલ

SHIKHARJI
SHIKHARJI'S FIRST & ONLY HOTEL WITH FACILITY LIKE★★

Continental
MADHUBAN - JHARKHAND

શ્રી ક.દ.ઓ. જૈન મહાજન, ગદગ

પર્યુષણ પર્વની ઉજવણી

અત્રે પર્યુષણ પર્વ ખૂબ રૂઢી રીતે ઉજવવામાં આવેલ આરાધના કરાવવા શ્રી આર્યરક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠ તરફથી મુંબઈથી શ્રીમતી ધનવંતીબેન ધીરજલાલ સાવલા તથા શ્રીમતી સાધનાબેન મધુકર નાગડા આવ્યાં હતાં. દરરોજ સવારનાં ભક્તામર સ્તોત્ર, વ્યાખ્યાન, સાંજે પ્રતિક્રમણ તથા રાત્રે ભક્તિભાવનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પર્યુષણ પર્વના આયોજનની જવાબદારી શ્રી કે.ડી.ઓ. મહિલા મંચ-ગદગ એ સ્વીકારી ખૂબ સારી રીતે સંભાળી હતી. પર્યુષણ પર્વનાં સર્વે કાર્યક્રમો નવીની કરણ થયેલ મહાજનવાડીમાં રાખવામાં આવ્યા હતાં તપસ્યા આ મુજબ થઈ હતી.

શ્રીમતી અલકા ભુપેન્દ્ર ખોના : ૩૦ ઉપવાસ અઠ્ઠાઈ તપસ્યા: શ્રી વિપુલ કાંતિલાલ મોતા, ભરત વીરજી ગાલા, વીરલ મેહુલ નાગડા, કુ.નિધિ કુમારપાળ લાલકા, કુ. લિપિ કુમારપાળ લાલકા.

ભાદરવા સુદ ૪ રવિવાર ૮-૯-૧૩ ના શ્રી પાર્શ્વ યુવક મંડળ તરફથી સ્નાત્રપૂજા ભણાવવામાં આવી હતી. શ્રી કલ્પસૂત્ર પદરાવનાર લાભાર્થી શામજી જેઠાભાઈ લાલકા: ૨૦૧ મણ. પ્રભુજીનું પારણું પદરાવનાર લાભાર્થી શ્રી પદમશી ઘેલાભાઈ મોતા ૭૧૧૧ મણ અને સ્વપ્નાનું કુલ ધૃત ૧,૬૪,૫૫૫ મણ થયેલ.

શ્રી કલ્પસૂત્રની શોભાયાત્રા, ભાદરવા સુદ ૧ના ચૈત્ય પરિપાટીની શોભાયાત્રા અને ભાદરવાસુદ ૬ ના બપોરનાં શ્રી પ્રભુજીના પારણાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

તા. ૧૦-૯-૨૦૧૩ નાં શોભાયાત્રા સંપન્ન થયા બાદ સાંજે શ્રી પદમશી ઘેલાભાઈ મોતા તરફથી ચઉ વિહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

ભાદરવા સુદ બીજનાં કુંવરબાઈ નાગશી ઘરમશી તથા મીઠીબાઈ લાલજી લુઠીયા તરફથી સફળ સંધને (કાયમી) જમણું આયોજન કરવામાં આવ્યું હતું. ભાદરવા સુદ ૪ નાં રાત્રે સામૂહિક સાંજીનો તથા કાયમી સ્કોલરશિપ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અઢાર અભિષેકને દિવસે, કચ્છી નૂતન વર્ષે તથા પર્યુષણ પર્વના મુખ્ય દિવસો એ શ્રીમતી નિશા નલિન મોતાએ પ્રભુજીની સુંદર આંગી ભરી હતી.

ભાદરવા સુદ ૬ તા. ૧૦-૯-૧૩ ના સવારના જ્ઞાતિ

શિરોમણી શેઠ શ્રી નરસી નાથાની છબીને ફૂલહાર ચઢાવવાના લાભાર્થી જીવન સંઘ્યા (વૃદ્ધાશ્રમ) ના ટ્રસ્ટી ગણે રૂ. ૪૫૪૫ માં આ લહાવો લીધો હતો. ત્યાર બાદ સામૂહિક ક્ષમાપનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અતિથી વિશેષ તરીકે આપણી શાળાનાં સેક્રેટરી શ્રી ચંદ્રકાંત લાલજી લોડાયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં પાંચ દ્રવ્યનાં વાર્ષિક ચઢાવા બોલવામાં આવ્યા હતા. જેનાનીચે મુજબ આદેશો અપાયા હતા:

૧. દુધ - નમણ : શ્રીમતી જવેરીબેન ત્રિકમજી લોડાયા રૂ. ૭,૭૭૭/- ૨. કેસર પાણી : શ્રીમતી ગુણવંતીબેન કુંવરજી લોડાયા : રૂ. ૧૦,૦૦૧/- ૩. પુષ્પ : શ્રીમતી વીણાબેન નરેન્દ્ર લુઠીયા : રૂ. ૧૧,૧૧૧-૪. ધૂપ-દીપ : શ્રી પાર્શ્વ ફેન્ડ સર્કલ : રૂ. ૧૧,૧૧૧- ૫. ચંદન : શ્રીમતી નવલબેન નવીનચંદ લાલકા : રૂ. ૨૦,૨૨૨/-

શ્રીમતી મલ્યાકુમારી કુમારપાળ લાલકા, શ્રીમતી ગીતા સતીશ લુઠીયા અને શ્રીમતી કોમલ મેહુલ નાગડાએ આરાધક બહેનોનું સન્માન કર્યું હતું. શ્રીમતી દક્ષાબેન સુધીર સોનીએ પર્યુષણ પર્વનો અહેવાલ રજૂ કર્યો હતો. મહાજનશ્રીના પ્રમુખ શ્રીનવીનચંદ શામજી લાલકાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. મહાજનવાડીના નવીનીકરણ માટે સેવા આપનાર જીતેન્દ્ર મોરારજી પટેલ, વિપિન રતિલાલ મોતા, સંજય ઠાકરશી મોતા, સુધીર જવેરચંદ સોની તથા વિજય પ્રવીણચંદ લુઠીયાનું સન્માન કરાયું હતું. શ્રી ચંદ્રકાંત લાલજી લોડાયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ઉપ પ્રમુખ હરીશ શિવલાલ મુનવરે દેરાસરના સ્ટાફ મેમ્બરોને કેશ કવરનું વિતરણ કર્યું હતું સેક્રેટરી સતીશ પ્રવીણચંદ લુઠીયાએ ઈનામ વિતરણ તથા સ્મરણ ચિહન અર્પણ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. જોઈન્ટ સેક્રેટરી મેહુલ મણીલાલ નાગડાએ દેરાસરને ભેટ મળેલ ચીજોનો અહેવાલ રજૂ કર્યો હતો. શ્રીમતી મણીબાઈ કાંતિલાલ શાહ કાયમી શિક્ષણ પ્રોત્સાહક ઈનામો કુલ ૪ વિદ્યાર્થીઓને (દરેક ને રૂ. ૫૦૦૦) આપવામાં આવ્યાં હતાં મહિલા મંચનાં પદાધિકારીઓ શ્રીમતી મુલકુમારી કુમારપાળ લાલકા (પ્રમુખ), શ્રીમતી દીપિકા જયેશ શાહ (ઉપપ્રમુખ), શ્રીમતી દીપ્તી મૌનેશ લુઠીયા (સેક્રેટરી), શ્રીમતી શીલ્પા ગિરિશ નાગડા (જોઈન્ટ સેક્રેટરી), શ્રીમતી દક્ષા સુધીર સોની (ખજાનથી) તથા સભ્યોએ પર્યુષણ પર્વ ઉજવવા સારી જહેમત ઉઠાવેલ.


ઉપરોક્ત કાર્યક્રમનું સંચાલન શ્રીમતી દક્ષાબેન સુધીર સોનીએ ખૂબ સુંદર રીતે કર્યું હતું.



ABDASA (KACHCHH) GAUSHALA TRUST

(Trust Regn. No. E-2071-Kachchh P.A. No. AABTA 7039 A)

C/o. Vipul Shivji Damaji, Village Rapar Gadhwal, Taluka Abdasa (Nalia).
Dist. Kachchh, Gujarat State - 370 645 Tel. : (02831) (952831) 273256.



Mumbai Office : 602-B, Prem Nagar No. 6, M.C.F. Udyan Marg, Borivali (W), Mumbai - 400 092.
Tel. : 2893 6173 / 2890 4500

નવા/બદલાયેલા સરનામા- (પુરું નામ અને નવું સરનામું મોકલવાની સાથે જુનું રદ કરવાનું સરનામું અવશ્ય જણાવવું)

ચિમનલાલ કે ધરમશી	પદ્મભાવતી હા.સોસાયટી બંગલો નં. ૩૦, બાલ ગૃહ રોડ, દેવલાલી, જિ. નાશિક
રાજેન્દ્ર ગોવિંદજી ખોના	૨૪૪, સુદર્શન બિલ્ડીંગ, ૩જે માળે, તમિલ સંઘમ હોલ સામે, મુંબઈ તમિલ સંઘમ રોડ, સાયન પુર્વ, મુંબઈ - ૪૦૦ ૦૨૨
હર્ષ મોમાયા	સી- ૧૦૨, આશાનગર, ફેઝ - ૨, પી.કે.કો.સ.રોડ, સાઈધામ પાછળ, મુલુંડ (વે) મુંબઈ - ૮૦
રજનીશ ચંદ્રકાંત નાગડા	કે/ઓ. પુષ્પ-પ્રભા બંગલો, ફ્રીટવેલ ટેલરની બાજુમા, કેલા નગર, કેલા પોષ્ટની સામે, ખામગાવ, ૪૪૪૩૦૩, જિ. બુલઢાણા, મહારાષ્ટ્ર

નવા/બદલાયેલા ફોન નંબર

લલીત કુવરજી ખોના, ડોંબિવલી	09920403950	કિરણ લાલજી પટેલ, જયપુર	09414043018
રજનીશ ચંદ્રકાંત નાગડા, ખામગામ	09420338922	પુષ્પા કિરણ પટેલ, જયપુર	09828861877

જીવનચક્ર (જીવનચક્ર માટેની વિગત છપાય છે તે પદ્ધતિ અનુસાર વ.પ.કુ.નં. સાથે જ મોકલવી)

જન્મ

૨૨.૦૮.૧૩	રાયચુર	અક્ષત રિટા/વિનય હંસરાજ લોડાયા	વારાપધર	પુત્ર
૦૮.૧૦.૧૩	કોઠારા	તેજસ સચિન વિશનજી હીરજી મુનવર	કોઠારા	પુત્ર
૧૦.૧૦.૧૩	મુલુંડ	ધિયા-ગ્રિષ્મા/ કમલેશ ખુશાલ લોડાયા	બાંડીયા	પુત્રી

સગપણ

૧૫.૦૮.૧૩	ઘાટકોપર	તિમીર નિલેશ આસર	અંજાર	૨૫
	ઘાટકોપર	અંકિતા રાજેન્દ્ર ખોના	ધ્રાફા	૨૪
૧૮.૧૦.૧૩	ગાંધીધામ આદિપુર	મિકીર લહેરચંદ આણંદજી ખોના	સાંધવ	૨૩
		હેતલ રાજેશ સોમચંદ નાગડા	નલિયા	૨૦

આંતર જ્ઞાતિય સગપણ

૧૩.૧૦.૧૩	સાંતાકુઝ	કરણ ચતિન મણિલાલ શાહ	અમદાબાદ	૨૬
	સાંતાકુઝ	કોમલ કિરણ હંસરાજ લાપસિયા	દલતુંગી	૨૬

લગ્ન નોંધ

૦૭.૧૦.૧૩	પુના ગદગ	કૌશીક મહેન્દ્ર દેવજી નાગડા	રંગપુર	૩૫
		અર્ચના હરીશ શિવલાલ મુનવર	જખો	૩૪

મરણ

૧૮.૧૦.૧૩	ડોંબિવલી	વિલાવંતી ચાપસી કુવરજી દંડ	સાંધવ	૭૬
૨૧.૧૦.૧૩	ગોરખડી	મુરબાઈ રૂપશી જીવરાજ લોડાયા	ગોરખડી	૮૨
૨૨.૧૦.૧૩	મુલુંડ	પુરબાઈ શામજી ભીંચસી ધરમશી	સુથરી	૮૦

સરનામાની સી.ડી. ભુલરહિત કરવાનું કામ ચાલુ છે : અંકો ન મળવાની ફરિયાદ ઓછી થશે : ધીરજ રાખવા વિનંતી

અંકો ન મળવા, જુના સરનામે પણ મળવા, બહારગામમાં મોડા મળવા પાછળ સરનામાની સી.ડી. માંની નાની-નાની ભુલો જવાબદાર છે એવું ધ્યાનમાં આવતા તેને ભુલ રહીત કામ ચાલુ છે તે પછી અંકો ન મળવાની ફરિયાદો ઓછી થશે. જો કે ત્યાં સુધી જુના સરનામા કાઢવા તથા નવા દાખલ કરવાનું બંદ રહેશે તેની નોંધ લેવા વિનંતી.

- વ્યવસ્થાપક

તમારા જીવનના સર્વે શુભ પ્રસંગમાં સહભાગી થવા ઉત્સુક



રિશી ફુડ્સ એન્ડ સર્વિસ
સદા સર્વાંગી સેવા કરીને ધન્યતા અનુભવશે

We Cater all Types of Veg. Cuisine (Mexican - Italian - Burmese etc.)

Chintan Shah (Lodaya) : 9619681919 Tel.: 022- 321 09097
Email : chintan_shah72@yahoo.com
Office : Sardar Pratap Singh Industrial Estate No. 3,
Shop No. 7, Opp. Panalal Compound,
L.B.S. Marg, Bhandup (West) Mumbai - 400 078

તહેવાર સંપુટ : પ્રકાશ અને હકારાત્મક ઊર્જાનો



ભાગ્ય પ્રકાશ મળે :
સુખ-શાંતિ-આરોગ્ય-ધનસંપદા...
હે દિપ જ્યોતી નમન તર્ને...

દિવાળી એક વિશિષ્ટ તહેવાર સંપુટ
વાઘ (વાહ) બારસ સુધી કરી સફાઈ કાઢવી નકારાત્મક ઊર્જા,
ને કરવી જગ્યા હકારાત્મક ઊર્જા માટે...
ધનતેરસના લક્ષ્મીપુજાથી કરવી સંસ્કાર લક્ષ્મી, લક્ષ્મીને....
કાળીચૌદસના કાઠી કકડાટ, દેવું ખુશાલીને નિમંત્રણ....
દિવાળીના શારદા પુજનથી કરવો સદ્વિધાનો જયજયકાર...
દિવાળી એટલે વીર પ્રભુનો દેહમુક્તિ ઉત્સવ અને
ગૌતમ સ્વામીના કેવલ જ્ઞાન પ્રાપ્તિનો અવસર
એને માત્ર બાહરના દિવાઓ પુરતો સીમિત કેમ કરાય ?
એ દિવસે તો અંતરે દિવો પ્રગટવવો જોઈએ....
બેસતા વરસે શુભકામનાની આપ-લે કરી,
નવા વર્ષનો કરવો શુભારંભ...
ભાઈ-બીજના છોડી વ્યસ્તતા,
ભાઈ-બેઠનના સંબંધ રાખવા તાજા...

દિપોત્સવ અને નૂતન વર્ષની શુભ કામના
પ્રકાશ સમીક્ષા પરિવાર



નિર્મલ નજરે

કચ્છી મોર



ફોટોગ્રાફર : નિર્મલ દંડને પ્રવાસનો શોખ છે, તેઓ પ્રકાશ સમીક્ષાના વાચકોએ કેમેરાની નજરે વિવિધતાનો સાક્ષાત્કાર કરાવશે

**નાનાણા નાગડા પરિવારનું
અને દાદાણા મૈશેરી પરિવારનું ગૌરવ**



હાર્દિક મૈશેરી

એ B.E. (Electric & Communication) ની ફાઈનલ પરીક્ષા ૯૬% થી પાસ કરી પરિવારનું ગૌરવ વધારેલ છે.


તે સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન અને ઉત્તરોત્તર યશસ્વી ભાવિની શુભેચ્છાઓ

આકાશને અડકે છે તારી સિદ્ધિ તારા થકી નાનાણા-દાદાણા પરિવારની થાય ખુબ પ્રસિદ્ધિ

... શુભાશિષ ...

- નાનાણાં : ગં. સ્વ હિરબાઈ મેઘજીભાઈ નાગડા (ભુજ)
મામી-મામા : સૌ. ચેતના કિરણ નાગડા (ભુજ)
સૌ. વૈશાલી હરીશ નાગડા (ભુજ)
સૌ. અનીતા હીતેશ નાગડા (ભુજ)
માસી-માસા : સૌ. કુસુમ સુરેશ શાહ (ભાવનગર)
સૌ. જયશ્રી જયંત શાહ (મુલુન્ડ)
સૌ. પલ્લવી જયસુખ મહેતા(ભુજ)

**મૈશેરી પરિવારનું ગૌરવ
હાર્દિક અભિનંદન**



હાર્દિક મૈશેરી

એ B.E. (Electric & Communication) ની ફાઈનલ પરીક્ષા ૯૬% થી પાસ કરી સમસ્ત વાપીમાં પ્રથમ આવી ...

"BEST MERITORIOUS DEGREE ENGINEER FOR THE YEAR 2012-13" ની

Er N M Shah ટ્રોફીના વિજેતા થઈ....

પરિવારનું ગૌરવ વધારેલ છે.

તે સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન અને ઉત્તરોત્તર યશસ્વી ભાવિની શુભેચ્છાઓ

... શુભાશિષ ...

- દાદાણાં : સ્વ. અ.સૌ. મણિબાઈ દામજીભાઈ મૈશેરી (વડાલા) (નલીયા-કુવાપધ્ધર)
માતા-પિતા : સૌ. પુષ્પા ભરત મૈશેરી (વાપી)
કાકી-કાકા : સૌ. ઉષા શૈલેશ મૈશેરી (વડાલા)
ફઈ-કુઆ : ગં સ્વ દેવકુંવર અજીત લોડાયા (મુલુન્ડ)
સૌ. મીના ભરત પીર (મુલુન્ડ)
સૌ. ઉષા રમેશ ખોના (કોચીન)
સૌ. રાજુલા અતુલ કુરવા (આંસનગાંવ)

To,

If undelivered, please return to :

C.D.O. PRAKASH SAMIKSHA, C/o. Shri. R.R. Nagda, 29/41 Tamarind Lane, Rajabhadur Compound, Near Stock Exchange Bldg., Fort, Mumbai - 400 001. Printed & Published by JAYANT V. CHHEDA on behalf of C.D.O. PRAKASH SAMIKSHA SAMITI (Owner) and Printed at SUMANGAL ARTECH, Plot No.G-8, Cross Road, 'A' M.I.D.C. Andheri (East), Mumbai - 400 093 and Published from 115, Tirupati Industrial Estate, Subhash Nagar, Village Road, Bhandup (West), Mumbai-400 078. Editor : Raichand R. Nagda